



BASA **ZORABIAN**

Seven Seas Food

Specialist In Imported & Desi
BASA, BOI & PRAWNS
All Types of Fishes & Zorabian Range Of Products Available.
**FOR FREE HOME DELIVERY CONTACT
09321 0000 65 • 09324 776511**

Moving Abroad On a project? Renovating Home/Office?

- Need a secured space for storing your personal/Office effects? Call us !!
- Complete mobility solutions from packing, transport & Storage with Lock & Key facility starting @Rs. 85/- per month/sq ft on plastic pallets.
- Containerized & Dedicated storage boxes also available for sensitive shipments.
- **Hassle free International & Domestic moves.**

IT'S YOUR STORE ROOM **Gurukrupa**
PACKERS & MOVERS
Total Solution for Peace of Mind
9324254460 / 28402074/75

LEARNERS LICENCE ISSUED AT WIAA
W.I.A.A has 100 years of Existence. WIAA is authorized by R.T.O to conduct the test and issue Learners Licence for all RTO offices in Mumbai - RTO (Central Zone), RTO (Western Zone), RTO (Borivali) and RTO (Eastern Zone). Also Test for Permanent Licence.

DRIVE HOME THE BEST CAR INSURANCE PLAN WITH DOSSA INSURANCE!

- Renew your existing policy from any insurer
- Renew your existing Policy
- Buy New Policy **SPECIAL DISCOUNT FOR CCI MEMBERS**

'AA' OVERSEAS
Mediclaim Policy
at a Very **ATTRACTIVE PREMIUM**

CAR INSURANCE
Get the 'AA' Insurance Advantages
Upto 80% Discount Plus Rs. 500/- Discount to WIAA members

To Avail the offer contact us at
Contact Details : 022-22656565 / 8369118064 email: motorins@dossainsurance.in

THE INTERNATIONAL DRIVING PERMIT (IDP)
The International Driving Permit (IDP) is recognized worldwide as a valuable document identifying motorists as legally-licensed drivers, in the country they are travelling.
Who can Apply: Indian driving license holders intending to drive in a foreign country can apply for an IDP. An IDP is valid only for one year from the date of issue. 8369118064 email: motorins@dossainsurance.in

WIAA
ROADSIDE ASSISTANCE

KEY FEATURES: Flat Tyre • Fuel Assistance* • Towing Assistance up to 20 km from the breakdown spot • Minor on-road Assistance • Battery Jump Start • India Wide Coverage

for assistance please call **1800 220 200** or write us on rsa@wiaaindia.in *For complete Terms & Conditions, please refer to our RSA T&C Booklet

Now Join WIAA and get **24x7 Breakdown Service** **CELEBRATING CENTENARY YEAR**

Cawas Sorabji Panthaki - A Tribute

By **Kersi Randeria**

Page 04

Finance Feature: Avoid Herd Mentality While Investing

By **Marzee Kerawala**

Page 05

Astrophysicist Nergis Mavalvala Named Dean Of MIT School Of Science

Page 06

SII Registers COVID Vaccine Trial

Trials to be conducted across 17 sites pan-India, including AIIMS (New Delhi)

Page 08

FROM THE EDITOR'S DESK



Dear Readers,

It is said that every truly successful journey begins on a note of gratitude, and as we begin the journey of the new orbit marking the Parsi New Year, I thank all our readers, on behalf of Parsi Times, for your unflinching and ever-increasing support and patronship, through the years.

Team PT especially extends heart-felt gratitude for your very kind feedback and words of encouragement and appreciation for our Parsi New Year Special issue. Like one of our readers wrote in, "Hope is exactly what we needed during these difficult times and your New Year Special issue's theme, 'Celebrating Hope' hit the mark bang-on! The content was so positive and inspiring for us to read that it really helped set the tone for a truly happy New Year. And seeing our very own Ratan Tata greet the comm brought a smile to all our faces!"

Indeed! We are truly thankful to Shri Ratan Tata, for yet again greeting the community via Parsi Times on our most auspicious occasion. Many of our readers also wrote in about the added sense of joy on being finally able to hold the physical copies of their favourite newsweekly, after months of patient waiting. Team PT is delighted to restart the delivery of our physical newspapers to you, though, it might not reach all subscribers mainly due to absence of vendors (most having returned to their villages) or areas deemed containment zones. We request your patience even as we are doing our best to reach PT to

all our subscribers. Kindly connect with us (editor@parsi-times.com) if your vendor is unable to deliver your copy.

The low-key festivities this year remind us that we still have a long way to go before we can shut the book on the pandemic chapter, but till then, let's play the best hand with the cards we've been dealt. Let's identify and embrace this new world order which calls for greater kindness towards each other and compassion for all of His creations. How about a few of our very own Parsi New Year Resolutions?

Let celebrations be understated, let's overdo giving to those in need;

Let's adhere to social distancing, but never let our hearts recede;

Let's wash away all negativity as we lather our hands,

Let sanitization, also, to our spirituality, extend;

Let's keep those face-masks on, but discard the façade,

Let Honesty and Kindness be the measures of your scorecard;

Let's transform the story of our lives into an inspiring epic

Of how we united and fought, and vanquished this epidemic.

Have a lovely weekend!

- Anahita
anahita@parsi-times.com

LETTERS TO THE EDITOR

Re: Prayer Hall

I had emailed Mr. Dinshaw Tamboly, Chairman of the "Prayer Hall Services and Maintenance Trust" with a request to kindly respond and clarify on some prima facie irregularities I observed at the Worli Prayer Hall.

I received a 5-page response but none of the concerns were clarified to the point but vaguely justified in a generalized manner as can be evidenced in their response.

Clarifications sought were -

1. Covid or Non Covid, this Prayer Hall trust was not formed to 'Safe guard the interest of the reformist priest 'as has been quoted.
2. Why did the Trust use the Corona excuse to hike up the rates in June 2020 to Rs 48000/- ? Why the opportunistic attitude to fleece the community members at such times?
3. Why is it mandatory for the family to pay Rs. 48,000 for full 4 days prayer at the hall?
4. The reply mentions, "While the fees charged are agreed between the Panthaki and the family ' in which case why has the Trust fixed up the amount of Rs 42000 + 6000 =48000? The Trust should not engage themselves in matters not concerning them.
5. The Prayer hall according to the Trust is provided free. Why is the Coordinator collecting Rs6000/- as "incidental charges" and why is the Trust the decision-maker on charges? I quote from the response given. Quote 'The prayer hall services & Maintenance Trust does not come into the Picture' Unquote. Here the Trust is contradicting itself.

6. I had faced this issue in 2017 as well as in 2018 and I did speak to Mr. Faramroz Mirza who informed me that the amounts are fixed by the Trust. I later called up Mr. Dinshaw Tamboly from the prayer hall requesting a receipt of the so-called incidental expenses. It was never issued.

7. In whose pocket is Rs 6000 going to? In the response received from Mr. Dinshaw Tamboly states and I quote 'It is common practice to pay gratuities to staff who are helpful and it is invariably done even at Dunderwadi after utilizing their services. Although Ervad Mirza may

have said that these gratuities are meant for BMC staff, the amount collected is actually also distributed amongst our Security guards, the cleaners employed at the Hall and those who help with documentation and other formalities' unquote. Thirteen cremations took place in July 2020. Is Mr. Dinshaw Tamboly implying that an amount of Rs 78,000 that would have been collected as gratuities were distributed as tips to all Over and above the salary the Trust pays the employees? The fact is nothing is being offered for free. It might bear investigation to find out if the salary of the staff paid for July 2020 came this Rs78000/- or such collected. Over and above this, the Trust also requests for voluntary donations to take care of the staff salaries. So put together the tips and donations, the Trust is mostly run by donors of the family and gratuities paid by families and nothing is free as stated.

8. In 2017, a priest attending ceremony observed that the prayers recited were cut short. I was also a witness to this. The priest informed that for Rs 24,000 these are all the prayers that he can perform! The matter was also brought to the notice of the Coordinator Please do ask the priest at the prayer hall as to what prayers will be recited. The reformist priests don't even recite full prayers which makes the ceremony a ceremony serving no purpose! I am told there are 11 reformists priests conducting ceremonies. Negotiate and use their services. I have also heard of several complaints that the coordinator is rude and that the man needs to be put on a leash.

9. Mr. Dinshaw Tamboly keeps comparing The Prayer Hall to Dunderwadi. Let me remind him that the BPP issues a receipt and does not force families to pay Rs 6000 compulsorily.

Finally, my question that still remains unanswered by The Prayer Hall Trust is - Can a person, rich or poor, use the prayer hall for free without paying the Rs 6000? and tip people individually as per their wishes. If the charge is mandatory than remove the words ' Free use of prayer Hall ' and issue a stamped receipt from the trust for providing service and not account the same as a donation.

By Arzan J Ghadijally

PARENTS/ STUDENTS Think Win Win!

WE FOLLOW ALL SOCIAL DISTANCING AND ONLINE SAFETY NORMS

PROF. TUSHAR'S GROUP TUTORINGS

is now ONLINE via ZOOM APP/JioMeet MEETING

Accounts, Commerce, & Economics at Kemp's Corner

For ICSE/IGCSE/IB/ISC/FYJC/SYJC

Highly experienced and skilled teacher having more than 20 years of teaching experience

- Regular and Crash Courses conducted
- Regular Tests and Annual Test Series as per Board pattern

Prof. Tushar N. Vasudeo, M.Com (Hons)

Mob: 9320027373 | Email: prof.tusharvasudeo@gmail.com

Website: www.proftushar.in

IN LOVING MEMORY



KEKI J UMRIGAR

Feb 09th 1932 - Aug 11th 2020

Our dearest father and owner of Umrigar Stores, Keki Jamshedji Umriger, left for his heavenly abode from his home, on Tuesday August 11th at 8:00 AM in the presence of his near and dear ones.

While being a loving husband, father and grand-father he is known for his famous spices across Mumbai's iconic Parsi restaurants & amongst his loyal clientele built over the years. His selfless service to Ava Yazad in keeping our hallowed Atash Behram, Agiary and residential wells clean and their waters clear will remain a remembrance. His legacy continues thru his children.

He shall certainly live on in the hearts of those who knew him and acknowledged his service. We take this opportunity to thank him for being the guiding light in our lives and an example worthy to emulate of what it takes to be a true family patriarch and Zarthosti

Najoo, Parvez, Nilufer, Farida, Noshir.
Shahzad, Dilshad, Arish

All relatives & well-wishers

I Shall Cultivate A Passionate Carving For Knowledge

Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, 'Homage Unto Ahura Mazda' by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.



Let the passion of learning ever grow in me. Let me learn with a consuming passion. Ignorance darkens my understanding. Illumine my mind, Ahura Mazda, as the sun illumines the world. Enable my understanding to fathom the depths of knowledge.

There is heartache in my inner world when my reason leaves it hungry and thirsty. Let me read. Let me muse over the sayings and writings of the sages of old. Let me gather facts and gain knowledge. But let me do more. Let me think.

Let me not, in pursuit of knowledge, be a visionary or a dreamer. Let me not indulge in visions. Let me not be a sentimental, impractical idealist, lest I be led away into the wilderness of puerile superstition.

If the ideal is in truth the real, then, my Lord, keep me back from the visionary hallucination and lead to the truly real. Let not my mind make futile attempts to find out truth wholly by intuition and not by dialectics. Let me not labour to create mystical state by means of intense mental religious emotion to create an ecstatic state of mind. Let me beware of the charlatans and pseudo-apostles who, themselves victims of delusion or working deception, blindfold the ignorant and superstitious, the fickle and feeble-minded.

Give me clarity of vision. Sharpen my wits. Let not my imagination hold its undivided sway. Let me sift the true from the false and work upon the facts that emerge. Teach me to separate critically wheat from chaff and find facts. Help me to see with my mind's eye what my bodily eyes behold not. Give me power to visualize before my eyes what my mind thinks out. Let me not always fill my mind with the knowledge of others. Let me strive to know for myself. Let my learning pave the way to wisdom, O my All-knowing Lord.

Cawas Sorabji Panthaki – A Tribute



KERSI RANDERIA

The loss of Cawassa (as I would fondly call him) leaves a void that will be very difficult to fill.

He was as strict, as he was compassionate. He was as kind, as he was firm. He was a simple man dedicated to his work and totally committed to the welfare of the community.

Cawassa was a man who was not afraid to stand up for what was right. I was often surprised to see the firmness with which he would deal, even with the Trustees and not back off from a position he believed to be the correct one. This was the man, this was the CEO that I had the pleasure and privilege of working with, for the last four and a half years.

As a trustee, I repeatedly turned to Cawassa, for innumerable details and facts about the BPP or the FPZAI, most of which he had on his fingertips, or was given to pull out with the greatest of ease. His systematic and orderly filing of papers and his sharp and memory-retentive mind were his assets that greatly benefitted the BPP. I genuinely believe that no single individual in this Trust will have the same knowledge of all things concerning the Trust, as Cawassa did. This is the void that will be painful and most challenging for us all to fill.

Two small stories about my experiences with Cawassa, that I haven't shared with anyone till date, will demonstrate to our community members, the solidity and strength of his character and his unquestionable integrity...

When we became Trustees, Cawassa had already left the BPP, tired and fed up of the daily internal battles being fought by the then trustees, which had brought the trust to an unfortunate standstill for more than three years. He had sought employment under Mr. Mancherji Cama.

I remember meeting Cawassa just outside the lift of the BPP building, on the ground floor (near the well, in the school). We started talking and I asked him if he were willing to re-join the Punchayet again as the CEO. His reply

Cawas Sorabji Panthaki, our highly regarded BPP CEO, and a much respected and loved member of our community, passed away on 14th August, 2020, at 6:15 am, at Reliance Foundation Hospital, after braving a long and difficult illness. BPP Trustee Kersi Randeria shares a tribute...



was the true mirror of his indomitable character and uprightness. He said, "Mr. Mancherji Cama helped me out at a difficult time by giving me a job, and much as I would like to work for the BPP, I cannot forget his kindness and cannot be disloyal to him."

I asked him if he would be willing to re-join if I requested Mr. Cama to kindly relieve him of his current employment so he could come back and work at the BPP. Cawassa agreed, and thanks to Mr. Mancherji Cama, who willingly and graciously agreed to relieve him, Cawassa returned to the BPP. This showed the moral fibre of the man - Cawassa - for whom his word and loyalty reigned supreme.

The other anecdote that I wish to share is much more recent... and it displays the level of integrity and character of the man, which one seldom finds today in our fellow beings. When Cawassa fell ill earlier this year, no one envisaged the long and tough struggle he would have to undertake vis-à-vis his health.

When Cawassa was first admitted to the Breach Candy hospital, the BPP footed the entire bill amounting to almost Rs. 25 lakh. Not many knew how much this bothered Cawassa.

One day, I received snapshots or pics of a hand-written letter on Whatsapp, which was not very legible and even more difficult to decipher, as Cawassa's handwriting was always a challenge to most, sometimes including himself! However, I did manage to

read most of it and based on it, I was able to understand its content and his intentions.

A couple of days later, he called me, and we spoke about the letter he had written. He told me that I was the only Trustee that he wanted to speak with and with whose help he wanted to put his plan in place. Cawassa was a proud man and did not want his 'debt' to the BPP, as he thought of it, to remain unpaid...

He told me, as even his letter to me had said, that he wanted to sell his house, move to a smaller apartment and use the difference to pay off the amount the BPP had spent on his hospitalization. I convinced him to wait for some time, till he had regained his health and was strong enough to re-join the BPP, after which, I suggested to him that we would discuss it.

Unfortunately, Cawassa never regained his full strength and was again hospitalized, and after a long and belaboured struggle with life, he passed away, on the 14th of this month, leaving this major void that I feel, marking the end of the life of a man of true character, compassion, honesty and integrity.

These two anecdotes bear greater testimony to Cawassa's character, than any encyclopaedic account showering every appreciation and praise, that he was so deserving of.

We will miss you, Cawassa.

May your noble soul attain Garothman Behest.

Avoid Herd Mentality While Investing



MARZEE KERAWALA



Marzee Kerawala is a Certified Financial Planner with expertise in Income Tax and Investment products. Managing assets worth over Rs. 4 Billion, his firm 'NiveshIndia', designs Tailored Investment Strategy through Customised Financial Planning for individuals and NRIs, and also handles Treasury Management for corporates and SMEs. You can contact him at +91 9987567667 or Email: marzeek@niveshindia.co.in [Website is www.niveshindia.in]



The idea of making Big Money and Quick Money has always attracted people to stock markets. However, what most of them don't know, is making money in stock markets is simple, yet not easy. Apart from having sound processes and a financial plan, it requires loads of patience and discipline. Today, let's explore 'herd mentality', which should be avoided at all times while investing. It is a phenomenon where investors follow what other investors are buying, rather than following their own financial plan or Asset Allocation. It is often driven by the fear of missing out.

It is normal to get tempted by the prospect of becoming rich quickly. When a particular stock or asset is moving one side up, it gets frustrating for the onlooker, who is sitting on fence, to see people make money around him. The typical buyer's decision is usually influenced by the actions of his friends, neighbours or relatives. Thus, if everybody around is investing in a particular stock, (I see it happening a lot these days, in a particular company stock) the tendency for potential investors is to do the same.

But this strategy is bound to backfire in the long run - it's like going out for dinner with friends in a restaurant where the IPL match is being telecast live... even though you're not interested in the IPL, you find yourself cheering for a team and the next day you order its merchandise on amazon! That's typical herd mentality. When it comes to investing, herd behaviour can wipe off your capital. Proper research should always be undertaken before investing in stocks. But that is rarely done. Investors generally go by the name of a company. Most of the people choose this option because of two reasons - 1) Strong peer pressure: most people like to be accepted by a group, following them or doing what they do is often the result of a reaction to peer pressure; and 2) Irrational belief that a large no of people

cannot be wrong at the same time. Unless you have control over your biases and have sound domain in the field, it is very difficult to oppose the masses. Most financial crisis in stock markets are attributed to the human tendency called 'Herd Mentality'. History shows that most times investors buy a stock or invest in equities because everyone around is buying it. There is a strong temptation to act based on emotions rather than sound financial plan. We have many examples in history starting right from 1992 - the Harshad Mehta Scam - the Big Bull on Dalal Street turned wild, and along with it, blew away thousands of crores of investor's wealth and maybe a few investors too!

Another classic example of herd behaviour occurred in 1999-2000 - Dotcom Bubble. Investor's the world over invested in IT stocks. During those day, many non-IT sector companies changed their names and had prefixed or affixed info, tech, dotcom, global etc

to their names, just to sound similar to an IT company, and investors (including myself) had merrily lapped up stocks of many loss-making firms! A similar trend was again seen in the year 2006-2007. Investors had invested pots of money in Infrastructure Mutual Funds and NFO's. Five years after the mania, investors were still counting their losses!

2017 saw rise of Bitcoin mania, digital cryptocurrency, the price of which soared 25 times in a matter of one year. I personally know few friends, who, leave aside understanding the financial product, were not even able to spell it properly, but wanted my help and guidance to trade in this virtual currency. Bitcoin was first introduced as a payment system for day-to-day things like groceries, medicines etc. However, most people speculating in bitcoin did not buy the cryptocurrency to use it in such transactions, but to speculate and profit from continuous rise in past.

Investors that follow this herd mentality are always left disappointed to see huge negative returns, most times even perpetual capital wipe off at the end of each of these cycles. Always remember your PLAN is more important than your PORTFOLIO or PRODUCT. In the end, what such crises teach you is having the right priorities. In case your priorities for investments are not right yet, use this time to learn and correct them!

Pureganic's Amazing Pain Reliever - OMG

Article in Parsi Times on 'Home Care & Cure for Senior Citizens' dated 23rd May, generated very positive response. During interaction with readers, it was observed that due to continuous lockdown and restricted movements, many are complaining of severe to moderate Joint/back/shoulder pains, resulting into agony & discomfort. In order to create awareness both in terms of preventive and curative cure, Team Pureganic highlights the significance & benefits of OMG, which has proved to be very effective.

Pureganic offers unique combination of 3 products (OMG) prepared from natural sources, through plantations at organic Farms of Kutch, to give good

relief to users from various types of pains.

- 1. Ortho Tablets** - Made from Okra (lady finger - bhindi) and Moringa plants. Moringa removes the swelling from the joint and lady finger adds its lubrication.
- 2. Moringa Tablets** - Made from Moringa leaves powder, high in calcium and other nutrients for maintaining the strength of bones and joints. It protects liver, treats stomach complaints, mood disorders, heal wounds, diabetes/asthma/anemia.

3. Gum Tablets - It is high in natural glucosamine (a drug given for joint pain). It gets easily absorbed in the body which helps in cartilage/tissue

repairs & strengthening.

Burjor Patel - Eminent & Popular Theatre Personality writes, "I am using Pureganic OMG, for over a year for my back, neck, joint pain etc. and highly satisfied with the results. I am also using Purecolo & Sanjeevani Prash, both for immunity. I am now 90 and Pureganic products have been very useful in keeping me healthy and fit, with increased energy levels."

Pureganic offers range of organic, natural & health food products, with no side effects. For more information on products, their benefits & availability (Free Home Delivery at Mumbai), please Whatsapp/SMS on 9820812244.

JOINT PAIN
"OMG"
Get the power of Herbs to work for You

Tri-Shakti of tablets to give relief in knee pain & help fight effects of ageing, arthritis

Ortho-Tab
Combination of OKRA AND MORINGA
Natural Tonic that helps in building joint strength
Okra is known to increase lubrication
Moringa removes inflammation

Moringa-Tab
With awesome nutrients of Moringa Leaves
96+ nutrients, 46 Antioxidants
High in Calcium, Protein, Vit A
(for more details see Moringa leaves powder slide)

Gum-Tab
Power of Glucosamine
Natural occurring glucosamine
Easily absorbed in the body
helps in cartilage & tissue (repair + strengthening)
Also beneficial in Diabetes, ulcer, IBS


2 ortho in morn with milk/ water after breakfast
4 Moringa after lunch
2 GumTab at night after dinner

pureganic

9820812244

Soroosh Sorooshian Awarded Hydrologic Sciences Medal By AMS

Earlier this month, the AMS (American Meteorological Society) awarded the prestigious 'Hydrologic Sciences Medal' to Dr. Soroosh Sorooshian in its 2021 Awards and Honors program during its 101st AMS Annual Meeting. Every year, the AMS recognizes outstanding individuals and organizations of the weather, water, and climate community. Dr. Sorooshian, an Iranian-American distinguished professor of Civil and Environmental Engineering at the University of California Irvine, and currently serving as the Director of the Center for Hydrometeorology and Remote Sensing, was bestowed this award for "ingenious, ground-breaking work on surface hydrology and the remote sensing of precipitation that has profoundly impacted the field of hydrometeorology".



Dr. Sorooshian was born in Kerman, Iran in 1948 and is a member of prestigious organizations including the National Academy of Engineering and the International Academy of Astronautics. He was also Chairman for the Global Energy and Water Cycle Experiment of the World Climate Research Programme. In 2009, he was appointed as the California Council on Science and Technology member.

In 2005, Dr. Sorooshian was awarded the NASA Distinguished Public Service Medal and in 2006 was awarded the Robert E. Horton Memorial Lectureship award by the American Meteorological Society. A year later, he became a recipient of the Great Man-made River Water Prize which was given to him by UNESCO for his scientific activities at University of California and the Sustainability of semi-Arid Hydrologic and Riparian Areas, which is a division of the University of Arizona.

In 2010, he became the recipient of the 4th Prince Sultan Bin Abdulaziz International Prize for Water and was named Honorary Professor of the Beijing Normal University.

In 2005, Dr. Sorooshian was awarded the NASA Distinguished Public Service

the NASA Distinguished Public Service

ACE Young Actors Club




Since the lockdown started, Raell Padamsee's Academy for Creative Expression (ACE) has redesigned curriculums and taught over 1800 kids Speech and Drama online. For the teenagers, ACE brings you The Young Actors Club, which enhances children's confidence and perfects their communication skills with activities

like theatre games, debates, script writing and much more. Sign up now and get creative with age appropriate activities that are both fun and highly developmental at ACE - The Academy for Creative Expression. Connect: 9320130013 / 9773533332 for start dates or log on to: aceproductions.in

Advertisement

Astrophysicist Nergis Mavalvala Named Dean Of MIT School Of Science



On 18th August, 2020, Pakistan-born, Zoroastrian quantum astrophysicist Nergis Mavalvala has been named the new Dean of the prestigious MIT School of Science, one of the five schools of the Massachusetts Institute of Technology (MIT). As the hitherto Associate Head of the Physics Department, Mavalvala will take over as the new Dean from September 1, succeeding Michael Sipser, who will return to the faculty as the Donner Professor of Mathematics after six years of service, as per MIT News.

MIT President, L. Rafael Reif, commended Mavalvala stating that her "brilliance as a researcher and educator speaks eloquently for itself." He added, "What excites me equally about her appointment as dean are the qualities I have seen in her as a leader; She is a deft, collaborative problem-solver, a wise and generous colleague, an incomparable mentor, and a champion for inclusive excellence. As we prepare for the start of this most unusual academic year, it gives me great comfort to know that the School of Science will remain in such capable hands."

Mavalvala is renowned for her pioneering work in gravitational-wave detection, which she conducted as a leading member of the Laser Interferometer Gravitational-Wave Observatory (LIGO). As per the official report, "She has received numerous awards and honours for her research and teaching, and since 2015, has been the associate head of the Department of Physics. Mavalvala will be the first woman to serve as dean in the School of Science." She was also praised as "energised and optimistic" about her new role as Dean, even as she acknowledged the unprecedented challenges the school and the institute, as a whole, were facing during these challenging times.

The report added that the news was announced by Provost Martin Schmidt via a letter emailed to the MIT community, stating, "I very much look forward to working with her and to benefiting from her unerring sense of scientific opportunity, infectious curiosity, down-to-earth manner and practical wisdom. "I hope you will join me in congratulating her as she brings her great gifts as a leader to this new role."


Speaking on the occasion, Mavalvala said, "We're in this moment where enormous changes are afoot. We're in the middle of a global pandemic and economic challenge, and we're also in a moment, at least in US history, where the imperative for racial and social justice is really strong. As someone in a leadership position, that means you have opportunities to make an important and hopefully lasting impact."

Born to a Parsi family in Karachi, Mavalvala received her early education from the Convent of Jesus and Mary school. She later moved to the United States as a teenager, attending Wellesley College (Massachusetts), where she completed her BA in Physics and Astronomy in 1990 and a PhD in physics in 1997 from MIT. Prior to that, Mavalvala was she was a postdoctoral associate and then a research scientist at the California Institute of Technology (Caltech), working with LIGO.

In 2010, she received the prestigious MacArthur Foundation Award and in 2016, Mavalvala was part of a team of scientists credited with the discovery of gravitational waves, a new window for studying the cosmos.

Parsi New Year Greetings From Indian Leaders

Our much loved, respected and cherished community received wonderful New Year greetings from innumerable personalities and celebrities. The following are some of the greetings received from our President **Shri Ram Nath Kovind**, Prime Minister **Shri Narendra Modi**, Vice President **M Venkaiah Naidu** and the Congress General Secretary **Priyanka Gandhi Vadra**.



The President of India, Shri Ram Nath Kovind in his message on the eve of the Parsi New Year, said, "On the auspicious occasion of the Parsi New Year, I extend my heartiest greetings and best wishes to all the fellow citizens especially to my Parsi brothers and sisters. New Year's Day is an occasion of devotion, enthusiasm and celebration for the Parsi Community. This festival also gives us the message of extending our helping hand towards

the needy and maintaining cleanliness in our homes, workplaces and neighborhood. The contribution of the Parsi community in nation-building and development is a matter of inspiration and pride for all of us. May this festival of Parsi society based on the ideals of goodness in thoughts, words and deeds inspire all of us to imbibe positivity and to keep progressing in our social life through mutual harmony".



Conveying his wishes on Parsi New Year, Prime Minister Shri Narendra Modi, on Sunday, hailed the "outstanding" contribution of the community to the country. "Navroz Mubarak! Greetings on Parsi New Year. India cherishes the outstanding contribution of the Parsi community, which has made a mark in a wide range of fields. May the coming year bring peace and prosperity in everyone's lives," he tweeted.



Vice President, M Venkaiah Naidu extended greetings on Parsi New Year, saying the community held a special place in the cultural mosaic of the country. "India's Parsi community has made an invaluable contribution to nation building," he said in his message. "Celebrating Navroz in its true sense means imbibing good thoughts, doing good deeds, living truthfully and walking on the path of righteousness... As India and the world continue

to fight a relentless battle against COVID-19, this year people have to be content with a modest celebration which is confined to homes... May this festival bring amity, prosperity and happiness in our lives!" he added.



Congress General Secretary Priyanka Gandhi Vadra posted her greetings on Twitter, "Happy Navroze to all, especially to our darling Parsi aunties, uncles, cousins, nieces, and nephews in Delhi and Mumbai."

SII Registers COVID Vaccine Trial

The Pune-based Serum Institute of India (SII), a global frontrunner seeking to develop a safe and effective COVID vaccine, has registered its second and third phase trials of the Oxford-AstraZeneca Coronavirus (Covid-19) vaccine candidate - 'Covishield'- with the Clinical Trials Registry of India (CTRI). The trials will be conducted on 1,600 healthy participants across India.

New Delhi's prestigious All India Institute of Medical Sciences (AIIMS) is one of the seventeen sites selected to conduct Phase II and III, observer-blind, randomized, controlled study, to check the safety and immune response of the vaccine in healthy Indian adults. Planned as a 7-month study, the first enrolment is scheduled for the 24th of August, 2020, as per the CTRI.

The world's largest vaccine manufacturer by the number of doses produced and sold globally, the SII shares a manufacturing partnership with AstraZeneca to produce the Oxford-AstraZeneca vaccine. Dr. Prasad Kulkarni the principal investigator for SII, will spearhead the trials at the seventeen hospitals pan-India, including Andhra Medical College (Visakhapatnam); JSS Academy of Higher Education and Research (Mysore); Seth G. S. Medical College and KEM Hospital (Mumbai); KEM Hospital Research Centre (Vadu), B J Medical College and Sassoon General Hospital (Pune). While the KEM Hospital Research Centre's Ethics Committee has received the mandatory approval for the trials, the approval for the rest of the 16 hospitals is under process.

Covishield will be administered as a two-dose schedule on days 1 and 29 as 0.5 ml dose intramuscularly. Placebo will be administered as a two-dose schedule on days 1 and 29 as 0.5 ml dose intramuscularly. Healthy participants, both men and women, selected for the trials are above the age of 18. Those, who are ineligible, include people with acute illnesses with or without fever at the time of study vaccine administration, history of laboratory-confirmed Covid-19 disease in household contact or close workplace contact, etc.

Earlier on 7th August, 2020, SII announced that it would receive \$150 million in funding from the Bill and Melinda Gates Foundation and the GAVI vaccines alliance to make 100 million COVID-19 vaccine doses for India and other emerging economies as early as 2021.



Global Updates on the Development of Coronavirus Vaccine:

The Oxford-AstraZeneca vaccine candidate could well be the first to be available to India, provided it gets the required clearances by the year-end. SII has already received a nod from for India's top drug regulatory body for conducting phase-II and III clinical trials on the Oxford Covid-19 vaccine.

The World Health Organization (WHO) has called for a global pact aimed at providing easy and equitable access to Covid-19 vaccine. The COVAX global vaccines facility will drive funds from wealthier countries and non-profits to develop the vaccine and distribute it equitably around the world. The programme is aimed at delivering 2 billion doses of effective, approved Covid-19 vaccines by the end of 2021.

American biotechnology organisation, Moderna, the first US company to conduct the third phase of clinical trials of the potential vaccine, aims to enrol 30,000 volunteers for its trials (as per a CNN report).

As per PM Scott Morrison, Australia has secured access to a "promising" vaccine. Australia recently sealed a deal with Swedish-British pharmaceutical company, AstraZeneca to receive the vaccine it is developing with Oxford University. Morrison said that country would manufacture it and offer free doses to the entire population.

The state-owned Chinese pharmaceutical company, SinoPharm also said its vaccine will be commercially available by the end-2020. As per a Chinese daily, Chairman Liu Jingzhen assured that the vaccine would cost less than 1,000 yuan (\$140) and would be administered in two shots with a 28-day gap.

Fravashi Schools Wish Everyone Happy Parsi New Year & Khordad Saal Mubarak!

The late Mr. Ratanshaw Sorabjee and Education, founded the 'R. S. Luth Education Trust', in 1978.



Parsi Times congratulates and celebrates the success of our fab students and young achievers who have done achieved great success in their academic performances in Board exams across schools and colleges. We are delighted to feature our young, bright sparks who make our community proud! Do write in to us at editor@parsi-times.com with details if you would like to celebrate your success with our community too and feature in PT's Parsi Pride Brigade!

Here's extending our very Best Wishes for a Shining and Successful Future, alongside our Heartiest Congratulations to our Young Guns....

Marvelous Marc!

Marc Darius Boocha, from Pune's Bishops School (Camp Branch), scored a fantastic 97.7% (total percentage) in the ICSE exams. The son of elated parents - Avanti and Darius Boocha - Marc is blessed with a photographic memory and is fond of racket sports, making jigsaw puzzles, listening to music and playing PUBG. He has opted for the Commerce stream and wishes to pursue a career in Chartered Accountancy or Finance.




Shabaash Shehzan!

15-year-old Shehzan Workingboxwalla, from Bombay Scottish School, Powai scored a fab aggregate of 98% in the ICSE Board exams. The daughter of delighted parents - Pervez and Benifer Workingboxwalla, Shehzan has opted for the Commerce stream (with an overlap in Financial Markets) and plans to pursue a career in Investment Banking



Superb Sanaya!

Sanaya Gandhi cleared her SSC examination with 94.2% from Vasant Vihar High School and Junior College, Thane. The daughter of proud parents, Zarineeta and Sachin Gandhi, Sanaya holds a great academic track record. Her passion for Mathematics and a range of extracurricular activities has seen her amass a whole lot of accolades over the years from JMO (Junior Math Olympiad) to Homi Bhabha examinations; including a stint at the prestigious Princeton University, and being selected for the national level RAM TP (Raise A Mathematician) program.



Fravashi Academy, Nashik, came into existence in 1982. It is a school with a mission of imparting education to students with love and care, by providing every opportunity for their all-round development. It is located in the heart of the city and has classes from Nursery to Std. XII, the medium of instruction being English. The school has maintained its legacy of achieving 100% results, every year, at the ICSE Board Exam.

Mr. Ratan Luth took over as the Chairman of the Trust and Mrs. Sharvari Luth as Vice-Chairperson, twenty years ago, and since then the school has seen a rapid expansion in its infrastructure and upgradation of campus facilities.

We are privileged to be the first institution to be awarded the ISO 9001-2000 certification for our quality management system in North Maharashtra. We recently upgraded our ISO certification with ISO 9001-2015.

Fravashi International Academy, Nashik was founded in 2006 by Mr. Ratan Luth. It is spread across a 40-acre scenic campus adjacent to the Gangapur Dam backwaters and is rated amongst the top 10 boarding and day boarding schools in India. It has been awarded 'The Best Day Boarding And Boarding School In Maharashtra', in 2019, by the Mid-Day Group, Mumbai.

Mr. Ratan Luth has provided an infrastructure, which is at the cutting edge of educational technology, in the form of student-friendly classrooms, well-equipped library, state-of-the-art computers and science labs and modern educational teaching aids. In our endeavour to give the best education to the students, teachers are kept up-to-date with the ever-changing methods

of teaching by enrolling them in various teacher's workshops and seminars.

The Boarding facility, 'A Home... Away from Home', caters to the needs of Indian as well as international students who are looking for a safe, culturally rich and value-based educational scenario within Nashik.

We are proud of the achievements of our students who have represented us right up to the international level in academics, arts, sports and other co-curricular and extra-curricular activities.

Fravashi Schools is pleased to take the initiative of organising a **GLOBAL, ONLINE ART COMPETITION** to pay tribute to our Frontline Warriors, without whom this war against Covid-19 would be invincible. This initiative is to raise awareness and to make the children conscious of the sacrifices of our brave warriors.

The Global Online 'Fravashi Art Fiesta', is open to age groups of 5 to 16 years across the globe and is also open for children with special needs.

All participants should submit their paintings based on the topic of, 'World of your Dreams', through the online mode by 25th August, 2020.

The winners of all categories will be rewarded with generous prizes.

Registration link: <http://fia.edu.in/fravashiartfiesta/>

Participants may reach out to us on 9764350157, 9890004101, 7030940512 and follow our social media page, 'Fravashi World' on Instagram and Facebook.

Muktad In Perth



The holy Muktad prayers in Perth were yet again, as has been for the past almost fifteen years now, held at the home of Ervad Aspi and Farida Madan. Though the world is reeling under the COVID pandemic, Zarthostis in West Australia weren't under severe restrictions, thanks to the Government's stand on early lockdown and border closures in mid-March.

The local Zoroastrians brought in their vases for prayers a few days before the start of the Muktads to Er. Aspi's with fresh flowers et al. Every evening a short prayer for the departed with a Humbandagi was held, with people joining in from far and near. On 15th August marking Pateti this year, the Muktad Jashan and prayers were held, with almost 70 Zarthostis attending, who also brought food dishes which they enjoyed together, post prayers and chasni.

This year three local Ervads - Er. Aspi Madan, Er. Mahiyar Keravala and Er. Firdosh Behramkamdeen - performed the Jashan. It was a pleasant and auspicious occasion for the local Zoroastrian community to come together in prayer and interact. Similar Muktad prayers were held in other Australian cities including Sydney and Melbourne, as also in Auckland (NZ). Unfortunately, with the restrictions of the lockdown, they

could not have people gathering in most cities, with many New Year dinners and get togethers also standing cancelled, and low-key celebrations.

[Courtesy: Firoz Pestonji]



DHIRAJ
9819774578 **DHIRAJ**
Old Antique Items 8369666193

VALUE GIVEN MORE THAN MARKET RATE
WE ALSO COLLECT GOODS & GIVE FREE HOME SERVICE

OLD FURNITURE, WATCHES, OLD FOUNTAIN PENS, KERBA, OLD CROCKERY, OLD RESHAM KORE AND ZARI, OLD TOYS, OLD CAMERA, OLD NOTES AND COINS, GERMAN SILVER.

Bldg 12, 52/54 Haveliwala Bldg, Mint Road, Fort, Mum - 1

XYZ And Cusrow Baug Celebrate New Year By Giving To Frontline Workers



Keeping up with the Zoroastrian tradition of giving, the Cusrow Baug United Sports and Welfare League, along with XYZ's 'Daraius' Daredevils', donated essential equipment including masks, gloves, sanitisers, as well as a brand new desktop computer and colour printer to the Colaba Police Station.

These items were handed over to the Senior Inspector of the police station for use by all the police personnel. What started off as a drive to donate masks and sanitizers for the frontline police personnel, culminated into a larger activity thanks to the kind donations of the Cusrow Baug residents.



Finding Forgiveness

Veera is a published Author ('Endured' and '#LoveBitesLifeHacks') and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher... but most of all, a lover of all things literary.



VEERA SHROFF SANJANA

There is no knowing what people will do when they are about to die, but one thing is for certain, a human heart bleeds for forgiveness at death's door. Life starts as a clean slate, an empty book, gradually filled with your own hand and what destiny doled out generously, or held back tightly with meagre stance. But as the days to death come knocking and as your time draws nearer still, a conscious mind learns to clear the debris from the wreckage left by an ailing heart and a guilty mind.

As the night descends it is natural to brim over with every kind of sentimentality under the sun. Every day, you grow only more extravagantly wistful, especially in the evenings of your time here on earth, and emotions tend to spill their ink on pages written in a script that only you seem to understand. You read your life's book slowly, clearly, each word - a moment in time shared, lived, drawn on, without a rare sense of sorrow or disapproval, that the living years might otherwise have embarrassed your understanding. You put yourself in a place, cool and patient, calm and discerning, before you even begin to count the days to your end. Of the many parts of life we cannot escape, being hurt at the hands of another is especially painful. The reality of inviting other people into our lives is that we will at some time get hurt or we will eventually cause pain to others. That is the natural law all just the consequence of living a life. We may be selfish or selfless in turn hurting or being hurt. We could be deeply damaged by strangers or friends still. We may lash out or be privy to lose tongues and careless words. We could have painful seasons and never address the hurt or the person accountable for it. You may feel trapped, you may feel wrecked.

Now Forgiveness is such a beautiful concept. We certainly welcome it when we have made a mistake, acted inappropriately or hurt someone else. But forgiveness is rather difficult when



we have been severely wounded. Everyone thinks forgiveness a lovely idea until they have something to forgive. Anyone who has suffered a grievous hurt knows just how difficult true forgiveness really is. Sometimes the wounds are so very deep that your whole inner world is rudely disrupted.

Imagine a spouse or a parent betraying your trust, or you being the victim of an egregious crime or some life-altering abuse. Unfairly, the subject of some malicious slander or been harshly bullied. The turmoil and pain of it all so intense so deep - neither forgiveness nor forgetting seems a viable option. To think that forgiveness demands forgetting can be emotionally devastating. Sometimes you have been so deeply wounded and injured from the sinful actions or wrongdoings of others that forgiveness may seem farfetched and unfair. How is it even possible to ever forgive someone who has painfully disrupted and changed the course of your life? What if your wounds are not inflicted by a single random offensive act but a result of repeated deception and duplicity of the offender?

Forgiving someone does not mean you do not feel the pain of their offense any longer. Sometimes you have no choice but to move on from all that overwhelming hurt and injury. You could even be numbed. The absence of pain is not necessarily an indication of forgiveness. So what is forgiveness really? Psychologists generally define forgiveness as a conscious deliberate decision to release feelings of

resentment or vengeance towards someone who has harmed you. Forgiveness does not mean forgetting, nor does it mean condoning or excusing offences. It is neither minimising nor justifying the wrong meted out. To forgive the person is not excusing the act itself. Most importantly, forgiveness is neither about reconciling nor condoning. Forgiveness is given, despite never being asked for it.



True forgiveness is an apology you give yourself for another's wrongdoing. It is a gift to yourself and a positive step in moving forward. Forgiveness is rarely a one-time climatic event. It is about cancelling an old debt; it is about starting with a clean bill of health for your soul. Forgiveness, however troublesome, is about absolution-excusing the other from blame and guilt or even responsibility for their misdeeds. In a nutshell, it simply means to let the other person off the hook. We sometimes imagine it

as symbolically setting them free from having to carry the burden of suffering and guilt they may believe they've caused.

But what about all those times when an apology was never given, or there were no signs of remorse or contrition. What if they choose to continue the same negative patterns that caused the offense or hurt in the first place? What if, in fact, the person who caused you the most harm, believes they are still blameless? What if they are convinced their behaviour was warranted? How difficult is forgiveness then? Paradoxical as the act of forgiveness is, withholding forgiveness until we receive an apology or see remorse, is to relinquish control of our peace and future to one another. Forgiveness then becomes a deliberate act of kindness to oneself.

Forgiveness is about healing oneself. For some, it could come on suddenly, blessedly, almost like an epiphany of goodness without trying to think about it or create it. For others, it's a more deliberate process that may require time, effort and constant practice. But however you choose to forgive, the reward you reap is intense for your soul. Forgiveness may wash

upon you like the crash of waves or simple flow and ebb with feelings like the tide. There are infinite paths and different colours to forgiveness but true forgiveness is one's ability to meet the present moment with openness. Forgiveness means viewing and enjoying life without the lens of anger and resentment and the residue from the past. To put it simply, "Forgive not for all the hurt they caused you, but forgive for all the lessons they taught you!"

PARSI TIMES *PT Time Out*

The Bawa Word Search

Search out 16 Different Species of Monkeys in the World hidden in the word-jumble box below, in bi-directional, horizontal, vertical and diagonal forms:

C M Q P F X N X N K U W N X Z T A K W V Q E A L A
 P C E Y U Z L R G R A Y L A N G U R D O G V D H E
 G S O R C K T M P E D R K D H G U W Q T T R I R M
 H E D G U E R E Z A C I T G Z O M D D U V A Y J O
 Q Y A U Q C P F C U R K I M O M G Q A S L L C K J
 Z T S X Z Y N C G A X P G X Z R M B D J Z Q W G P
 E F M O H C P F K B N K O O M A K D A N U Z E M I
 C B K M O C D A A K K M T F C A Q M L S S G V K J
 D C C C K T U O F P J P Q A Z O I Y E Z A O A J K
 T O U D G D Y H Z R V J Q U P G S D G P K S V W C
 W U G O L U O M D P K U L L A L S V M J D G B K G
 R U V A D Z I T A Z E C G D P M S F G E X L D Y H
 L Y B T J D P N A N Y M E M D M R V C C A N B B S
 H Z Y E I W E E E T G G G Q R F V A A C F I M Q Y
 Q Y H S D Y R K K A R A H K Y X F E K Y D H M E R
 S M Z O Z S V L N I B P B C E E X H X V T C M O R
 T A Q M V P U K V A G A E E T X O B Q E O U D K D
 Z L T R E E D E G C H N B I Y W C S X U L P K X Y
 Z G A A G D T Q U S E S H O L S H F V J Q A F S H
 F U M M J P X I I C M W D E O K U U L U J C L R R
 A Q A T M K Z H O L L N R E G N W G E E L R V Z E
 G Z R A U J Y M O U P S G U R R U M D Y I B T Z R
 A J I B A D R I L L J I H E O A Y J V D E E C M W
 A Y N Y U S V O Z E T E J Q U Z R Z G L Q D A T F
 C X Y M Z L W G H A A K L B S E T N Q X J Q M T R

- | | | | |
|------------------|------------------|----------------|---------------|
| Mandrill | Macaque | Capuchin | Guinea Baboon |
| Bald Uakari | Marmoset | Tamarin | Gray Langur |
| White Faced Saki | Red-Shanked Douc | Sooty Mangabey | Guereza |
| Gelada | Black Howler | Grivet | Drill |



TechKnow With Tantra

Forest: Stay Focused

Forest presents an interesting way to get out of your phone addiction. If you want to temporarily put away your phone and focus on what's more important in real life, you can plant a seed in Forest! As time goes by, this seed will gradually grow into a tree. However, if you cannot resist the temptation of using your phone and leave the app, your tree will wither. Forest helps make better use of your time. You will be offered different species as you grow more trees. The paid, pro version even lets you plant real trees on the earth with tree-planting organization, 'Trees for the future' to protect the environment. Stay focused during these addictive cellphone times - Forest is the key!

Android: <http://bit.ly/2Z3Mf6F>


iOS: <https://apple.co/2Z17sh0>

SUDOKU

| | | | | | | | | |
|---|---|---|---|---|---|---|---|---|
| | | | 8 | | | | 5 | 9 |
| | 5 | 2 | 1 | 4 | | | | |
| | 9 | | | 7 | | 1 | | |
| 5 | | | | 9 | | | 7 | |
| 4 | | 3 | | | | 9 | | 5 |
| | 7 | | | 1 | | | | 3 |
| | | 4 | | 2 | | | 8 | |
| | | | | 5 | 3 | 2 | 9 | |
| 7 | 2 | | | | 8 | | | |

HOW MANY WORDS?

How many words of four or more letters can you make from the letters below? Every word must contain the letter in the center. You should make at least one word using all 7 letters.



RESULTS:
 Average - 7 or more words
 Good - 8 or more words
 Outstanding - 9 or more words

WINNING CAPTION!!!



After the 'GO CORONA, GO CORONA, CORONA GO' video, our leaders are now trying, 'BYE CORONA, BYE CORONA, CORONA BYE!!'

By Viraf P. Commissariat

CAPTION THIS!



Calling all our readers to caption this picture!

The wittiest caption will win a fabulous prize!

Send in your captions at editor@parsi-times.com by 26th August, 2020.

Disclaimer: Some of our 'Caption This' Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous vein, which is the mainstay of the Parsi spirit! No offence is intended to anyone or any situation.

Thought of the Week

"Feeling gratitude and not expressing it is like wrapping a present and not giving it."

- William Arthur Ward

THE TRUTH. DELIVERED WEEKLY.

વિખ્યાત - ડો. ખુશનુમા તાતા

જરથોસ્તી સમુદાયના ગૌરવ સાથે શસ્ત્ર ચલાવવાની તાલીમ

છવીસ વર્ષની નાની ઉંમરે, મુંબઈની ગોદરેજ બાગ નિવાસી - ખુશનુમા તાતા, જે મુંબઈની કેસી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભણાવે છે, કન્ઝ્યુમર બિહેવિયર ટુવર્ડ્સ રેડી ટુ ઈટ ફૂડમાં પીએચ.ડી કરીને સમુદાયને ગૌરવ અપાવ્યું છે. ખુશનુમાને મિઝોરમના રાજ્યપાલ તરફથી તેના ડોક્ટરનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

તેના સંશોધન પત્રો રાષ્ટ્રીય અને વૈશ્વિક પરિષદોમાં રજૂ કરવામાં આવ્યા છે અને યુજીસી કેર જર્નલમાં પણ પ્રકાશિત થયા છે. 'આંતરરાષ્ટ્રીય પરિષદ'માં તેણે રજૂ કરેલા કોવીડ-૧૯ દરમિયાન લોકોના ગ્રાહક વર્તણૂકને લગતા ૨૦૨૦: એક નવી દુનિયામાં એક નવી બજાર પરના તેના તાજેતરના પત્રો પર તેને 'બેસ્ટ રીસર્ચ પેપર' નો ખિતાબ મળ્યો.

પારસી ટાઈમ્સ સાથે વાત કરતાં ડો. ખુશનુમા શેર કરે છે કે, 'હું બારમા ધોરણમાં હતી ત્યારથી મારા નામ આગળ એક ઉપસર્ગ લાગે તેવું માંડે સ્વપ્ન હતું. પરંતુ હું કોઈપણ કિંમતે મારા સ્વપ્નનો પીછો કરવાનું છોડ્યું નહીં અને મેં મારી યાત્રા શરૂ કરી. જ્યારે મેં મારી પી.એચ.ડી. માટે પ્રવેશ મેળવ્યો તે સમયે કામ, અભ્યાસ અને ઘરનું સંચાલન કરવું પડકારજનક હતું! તેમ છતાં, મેં મારા જીવનમાં અશક્ય શબ્દને મંજૂરી આપી નથી. આ મુસાફરીમાં માંડે મુખ્ય સપોર્ટ સિસ્ટમ માંડે કુટુંબ છે - મારા માતાપિતા હુતોક્ષી અને બોમ્બી રાંદેલિયા જેમણે જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મારા સપનાને છોડવાનું નહીં અને લડવાનું શીખવ્યું. મારા પતિ, તોરાસ તાતા, જે મારા કરોડરજી સમાન છે જે મને પ્રોત્સાહિત કરે છે અને ટેકો આપે છે; મારી



બહેન જાસ્મિન અને મારા સાસરાવાળા જરૂ અદી તાતા અને નવાઝ તાતા જે મને સતત પ્રોત્સાહન આપે છે અના મેં કેસી કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું. વળી, મારા વિદ્યાર્થીઓ મારા જીવનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે - તેઓ મારી ડ્રાઈવિંગ ફોર્સ છે!

તાજેતરમાં, ખુશનુમાએ આર.કે. લર્નિંગ સ્ટુડિયો નામનું એક ઈન્સ્ટા હેન્ડલ સહ-લોન્ચ કર્યું છે, જે ધંધાની આસપાસની વિવિધ દંતકથાઓ અને તથ્યો સાથે સંબંધિત છે અને છબીઓ અને ઈન્ફોગ્રાફિક્સથી શીખવાની મજા બનાવે છે. તેનો હેતુ માર્કેટિંગ અને હ્યુમન રિસોર્સ ખ્યાલોને મનોરંજક બનાવવાનો છે અને તેના વિદ્યાર્થીઓ 'અનલર્ન એન્ડ રિલેર્ન' ના માર્ગને અનુસરે તેવી ખાતરી છે!

સમુદાયની કળા ઉચ્ચતમ બૌદ્ધિક માર્શલ આર્ટ છે. તલવારને હેન્ડલ કરવી એ સીધી કાર્યક્ષમ તકનીકીઓ સાથે સાદા સૌંદર્ય અને તીવ્ર ધ્યાન સાથે શાંતિની લાક્ષણિકતા છે. 'કેન્જુત્સુ' જાપાની તલવારબાજીની તમામ 'કોબુડો' (શસ્ત્ર પ્રશિક્ષણ) શાળાઓ માટે છત્ર શબ્દ છે.

આપણા ઝોરાસ્ટ્રિયન રત્ન - રેંશી વિસ્પી ખરાડી, ભારતની અગ્રણી અને શ્રેષ્ઠ માર્શલ આર્ટિસ્ટમાંના એક - સોશીલાન મેલુલ વોરા, મળીને આ કળા નિષ્પન્ન કોબુડો અને કેન્જુત્સુ ફેડરેશન - ઈન્ડિયા (એનકેકેએફઆઈ), અને જાપાની તલવારો અને વેપન ફેડરેશન - ભારત (જેએસડબલ્યુએફઆઈ) ના રૂપમાં ભારતીય માર્શલ આર્ટ્સ બિરાદરોને ભેટ આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે આ ભાગ સીધો 'મુગેરિયુ હીડો નિચિયુકાઈ - જાપાન' હેઠળ જોડાયેલો છે; 'નિહોન કોબુડો કુઓશિકાઈ - જાપાન' અને 'વર્લ્ડ કોબુડો ફેડરેશન - કેનેડા'.

ઉપરોક્ત સંગઠનો માટે ભારતના મુખ્ય પ્રશિક્ષક અને પરીક્ષક તરીકે એકમાત્ર ભારતીય લાઈસન્સ પ્રાપ્ત કરવા ઉપરાંત, સોશીલાન મેલુલ વોરા હેંશી ૨૦૦૫થી લાઈસન્સ પ્રાપ્ત શિક્ષક છે. સાત વખત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધારક, તંદુરસ્તી અને પોષણ નિષ્ણાત - રેંશી વિસ્પી ખરાડી એનકેકેએફઆઈના વડા છે; તે ગુજરાત પ્રદેશના પ્રેસિડન્ટ અને રાજ્યના સર્વોચ્ચ અને સિનિયર-લેવેલ બેલ્ટ છે.

રેંશી વિસ્પી ખરાડીની સિદ્ધિઓએ પારસી સમુદાયને ખરેખર ગૌરવ અપાવ્યો છે! તે કરાટેમાં



કેન્ડ્રમાં ઉભા છે - રેંશી વિસ્પી ખરાડી, નીચે બેઠા છે - રેંશી દારાયસ ફૂપર, તેના જમણે - સેન્સેઈ ફરજાના ખરાડી અને સેમ્પી યજ્ઞાન ખરાડી, તેની ડાબી બાજુ - સેમ્પી જમશેદ ફૂપર અને સેમ્પી જિદાન ખરાડી.

ચોથા ડેન બ્લેક બેલ્ટ છે, કુડોમાં બીજા ડેન બ્લેક બેલ્ટ છે, કેનજુત્સુમાં બીજા ડેન બ્લેક બેલ્ટ છે અને જુડો, જુજુત્સુ, કોબુડો અને કાવ માગામાં પ્રથમ ડેન બ્લેક બેલ્ટ છે (આત્મરક્ષણની ઈઝરાઈલી કલા).

પ્રશિક્ષકોની તેમની ગર્વની ટીમ અને ગુજરાતના પ્રથમ બ્લેક બેલ્ટમાં ૮ થી ૫૩ વર્ષની વયના જરથોસ્તીઓમાં- સેમ્પી યજ્ઞાન વિસ્પી ખરાડી (૮ વર્ષ) અને સેમ્પી જિદાન વિસ્પી ખરાડી (૧૧ વર્ષ) આ કળાના સૌથી યુવા પ્રેક્ટીસનરો છે! અન્યમાં રેંશી દારાયસ ફૂપર - કરાટેમાં પાંચમાં ડેન બ્લેક બેલ્ટ, કુડોમાં બીજા ડેન બ્લેક બેલ્ટ અને ત્રણ વખત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધારક - સેન્સેઈ ફરજાના વિસ્પી ખરાડી અને સેમ્પી જમશેદ દારાયસ ફૂપરનો સમાવેશ થાય છે.

સમુદાય અને દેશનું ગૌરવ બનવા બદલ રેંશી વિસ્પી ખરાડીને સલામ!


આજે, આપણે દિવસ વહેલી સવારે ચાના ગરમ કપથી શરૂ થાય છે. તે આપણી સિસ્ટમમાં બનેલી એક ફટિન છે અને લગભગ રોજ આપણે ગેસને પ્રકાશિત કરીએ છીએ, ચાની કીટલી મૂકીએ છીએ અને આપણી ચા તૈયાર થઈ જાય છે!

હવે હું તમને એક હજાર વર્ષ પાછળ લઈ જાઉં છું અહીં સવાર જેવું દેખાશે. તમે ઉઠો, તમારી પાદ્યાબ કરતી કરો અને સવારના નહાણને પૂર્ણ કરો. પછી તમે સગડી પર અગ્નિ સળગાવવા માટે ઉભા રહો છો અને તમારું વાસણ મૂકો છો. પછી તમે પ્રાર્થના કરવાનું શરૂ કરો, સંભવત, અરદીબહેસ્ત યક્ષ જેમ તમે પ્રાર્થના સમાપ્ત કરો છો, અગ્નિ પ્રગટશે અને તમારું સવારનું ભોજન બની રહ્યું છે. તમે તેને પહેલેથી જ સળગી રહેલી જ્યોતથી સળગાવ્યો નથી, તમે અગ્નિના તણા સાચવ્યા નથી અને તેને ફરીથી જીવંત કર્યો છે, તમે માચીસ અથવા એક પથ્થરને બીજા પર ઘસી અગ્નિ પ્રગટાવી નથી. સગડીમાં આગ સળગાવી તમારી પ્રાર્થના ની શક્તિથી પ્રગટ થયેલ છે! આનાથી પણ આશ્ચર્યજનક એ હકીકત છે કે ભોજન તૈયાર થયા પછી અને આગની જરૂરત

અરદીબહેસ્ત યક્ષ (૨)

પૂરી થતા, તે માત્ર અદક્ષ થઈ ગઈ! આનો અર્થ એ છે કે માંધવાણીએ જ તે જ્યોત બનાવી અને તેને પ્રગટ કરી નહોતી, પરંતુ તે એક એવી દિવ્ય શક્તિ હતી જે પોતાનું કાર્ય એકવાર થઈ જાય પછી તેને જાતે જ પાછું ખેંચી લે છે.

આ તકનીક એ માઝદાયસ્ની આસ્થાના સાધકોનું પવિત્ર જ્ઞાન હતું. આપણી પાસેના આ વધેલા મંત્રો વિશે બીજા કોઈને જાણ નહોતી અને ખરેખર, કેટલીક વાતો જણાવે છે કે લોકોએ તેમના પડોશીઓ પાસેથી આગ કેવી રીતે ઉઘાર લીધી હતી (તેઓ સંભવત જરથોસ્તી હતા!). જો કે, અહીં વાતમાં દિવસ આવે છે..



જ્યાં પહેલવાન કેરસાસ્પ એક શક્તિશાળી માણસ હતો. એક દિવસ તે શિકાર કરવા ગયો અને એક મોટો શિકાર કર્યો. પછી શ્રદ્ધાળુ માઝદાયસ્ની હોવાને કારણે, તેણે સગડી, સળગાવવા અગ્નિ માટે પ્રાર્થના કરી ત્યારબાદ તેણે માંસ રાંધવા માટે એક વાસણમાં અગ્નિ પર મૂક્યું. જો કે, વાસણમાં છિદ્રો હતાં અને તે વાસણમાંથી પાણી આગ પર પડ્યું અને આગ બુઝાઈ ગઈ તેણે બીજા વાર અગ્નિ પ્રગટાવી અને પાણી પડતા અગ્નિ પાણી બુઝાઈ ગઈ. આનાથી કેરસાસ્પ ગુસ્સે થયો અને તેણે ગુરજ (એક શસ્ત્ર જે તદ્દન ગદા જેવું છે) વડે આગ લગાવી. જ્યારે તેણે અગ્નિ પ્રગટાવ્યો, ત્યારે

તે ભૂગર્ભમાં પાછો ગયો અને પૃથ્વી, પર્વત, ખડકો અને ધાતુઓમાં ફેલાવ્યું તે પછી તે ગ્રહ પરના બધા માનવો માટે ઉપલબ્ધ બન્યું. અગ્નિ સમયના અંત સુધી આ બધી જગ્યાએ રહેશે. સંભવત: આ સમયે જ માનવજાતે અગ્નિની શોધ કરી.

કેટલીક વાર દરેક કિંમતી વસ્તુનો નાશ કરવામાં કોઈની એક ક્ષણ જ બસ લોય છે. તેથી તમે ભક્તિભાવપૂર્ણ અને નિષ્ઠાવાન હોવા છતાં, જો તમારી પાસે તમારી ભાવનાઓ પર નિયંત્રણ નથી, તો તમે હંમેશા તમે તમારા સારા સંબંધોનો નાશ કરશો, અને આસપાસના લોકો તમને નાસમજ વ્યક્તિ તરીકે જ સમજશે.

જે મંત્રથી તમે અગ્નિ પ્રગટ કરી શકો છો તેને તમે સહેલાઈથી મળતો ઉપહાર ન સમજો. આજે, આપણે સગડી પાસે ઉભા રહી મંત્ર ભણી અગ્નિ નથી પ્રગટાવતા, આપણી પાસે સ્ટવ અને લાઈટરની સુવિધા છે. પરંતુ તે તેજની કલ્પના કરો કે જે તમે તમારી અંદર આ મંત્ર સાથે બનાવી શકો છો!

- ડેઝી પી. નવદાર

એક નજર પારસી મરણો ઉપર

| Deceased મરનાર | Age વય | Date તારીખ | Address ર. ઠે. | Relations સગાઈઓ |
|---|-----------|---------------|---|--|
| Tehmi Hormusji Velati તેહમી હોરમસજી વેલાતી | 85 ૮૫ | 06-08-2020 | 811, Parsee Colony, Flat No.12, Jame Building, Dadar, Mumbai 14. ૮૧૧, પારસી કોલોની, ફ્લેટ નં. ૧૨, જામે બિલ્ડિંગ, દાદર, મુંબઈ ૧૪. | તે મરલુમો ધનમાય તથા હોરમસજી વેલાતીના દીકરી તે મરલુમો ડસ્તમ હોરમસજીદીયાર, રતી વરકીનબોક્ષવાલા, લીમ વેલાતી તથા બજી વેલાતીના બહેન. |
| Jehangir Pestonji Mistry જહાંગીર પેસ્તનજી મીસ્ત્રી | 81 ૮૧ | 07-08-2020 | 573, Umrigar Building. J. S. S. Road, 3rd Floor, Chira Bazaar, Mumbai 2. ૫૭૩, ઉમરીગર બિલ્ડિંગ, ૩જે માળે, જે.એસ.એસ. રોડ, ચીરાબજાર, ચંદનવાડીની સામે, મુંબઈ ૨. | તે ઝરીનના ખાવિંદ તે મરલુમ દીનામાય પેસ્તનજી મીસ્ત્રીના મોટા દીકરા તે જીમી અને મરલુમ દાલીના ભાઈ તે મરલુમ ખોરશેદ નવરોજી હોજદારના જમાઈ તે પીલુ, નોશીર અને ડો. કેરસી નવરોજી હોજદારના સાલા તે રુબી અને કેરી મીસ્ત્રીના જેઠ તે યજ્ઞદીન, હોશેદાર અને તનાઝના કાકા તે જેસ્મીન અને ખુશનુમાના કાકા સસરા. |
| Allan Dinyar Madan એલન દીન્યાર માદન | 72 ૭૨ | 07-08-2020 | 2nd Floor, Apartment No.7, 19, Pali Hill, Bandra (W), Mumbai 50. બીજે માળે, અપાર્ટમેન્ટ ૭, ૧૯ પાલી હીલ, બાંદ્રા (વે), મુંબઈ ૫૦. | તે દીન્યાર માદનના ઘણીયાની તે નેવીલ માદન, ઝવેર પંચાલ તથા દીલખુશ ભાટીયાના માતાજી તે મરલુમો જર તથા નોશીર કુપરના દીકરી તે બીનાયદર માદન, રક્ષીન તથા સંદીપના સાસુજી તે માણેક તથા દેવના માદનના અપઈજી તે હારદીક પંચાલ, શીવમ ભાટીયા તથા ભઈરવી ભાટીયાના મમઈજી તે મરલુમો નાજુ દાવર, ખુરશેદ કુપર ને બેહરામ કુપર તથા માણેક કુપરના બહેન તે મરલુમો પેરીન તથા રતન માદનના વહુ. |
| Edul Darabsha Shroff એદલ દારબશા શ્રોફ | 85 ૮૫ | 07-08-2020 | Parukh Dharamshalla, 34, Hughes Road, Old Khareghat Colony, Mumbai 7. પારુખ ધરમશાલા, ૩૪, હુજસ રોડ, ઓલ્ડ ખરેઘાટ કોલોની, મુંબઈ ૭. | તે મરલુમ ફરીદા એદલ શ્રોફના ખાવિંદ તે મરલુમો મોટા તથા દારબશા એદલજી શ્રોફના દીકરા તે હોમી દ. શ્રોફ તથા મરલુમ રોહીન્ટન દ. શ્રોફના ભાઈ તે સાયરસ રોહીન્ટન શ્રોફના કાકાજી. |
| Dhun Minu Bhathena ધન મીનુ ભાઠેના | 80 ૮૦ | 08-08-2020 | 19, Ratan Bldg., 2Nd Floor, Wadia Street, Tardeo, Mumbai 34. ૧૯, રતન બિલ્ડિંગ, બીજે માળે, વાડીયા સ્ટ્રીટ, તારદેવ, મુંબઈ ૩૪. | તે મરલુમ મીનુ દીનશાજી ભાઠેનાના ઘણીયાની, મરલુમ તેમીના જહાંગીરજી કાવસજી પટેલના દીકરી તે મરલુમ ધનમાય દીનશાજી ભાઠેનાના વહુ તે મરલુમ ખોરશેદ દાલી ડુમસીયાના બહેન તે શેહરૂ સામ ઈટાલીયા, ફેની બહાદુર પટેલ, દોલી ડાડી માડવીવાલા ને નોસીરના બહેન તે મેહરસાદ બી. પટેલ, ચીરાગ એસ. ઈટાલીયા, ખોરદાદ ને વલીસતા માડવીવાલાના માસીજી. |
| Perviz Kersi Siganporia પરવીઝ કેરસી સીગનપોર્યા | 80 ૮૦ | 09-08-2020 | 80- B, Naoraji House, Flat No.12, Naigam Cross Road, Dadar, Mumbai 14. ૮૦ બી નવરોજી હાઉસ, ફ્લેટ નં. ૧૨, નાપગાવ ક્રોસ રોડ, દાદર (ઈ), મુંબઈ ૧૪. | તે મરલુમો જાલામાય તથા બરજોરજી એદલજી બલસારાના દીકરી તે કેરસી દારાબશાહ સીગનપોર્યાના ઘણીયાણી તે બીનાઝ કેરસી સીગનપોર્યા ને કેશવર કેરસી સીગનપોર્યાના માતાજી તે મેહરૂ, પીલુ અદી મીસ્ત્રી, મરલુમો હોશંગ, ફીલી ને શીલ્કુના બહેન તે રોશન ફીલી બલસારાના નરણ તે એમી આન્ટીયા, લીલ્લા, કાલી ને દીનશાહ, મરલુમો મરઝબાન, મેહરૂ પોલ કુપરના ભાભી તે માણેક ને ફરીદાના જેઠાણી. |
| Ardeshir Homi Khushrushahi અરદેશર હોમી ખુશરવશાઈ | 56 ૫૬ | 09-08-2020 | 10/C, Lalkaka Bldg., Marzban Colony, Gilder Lane, Mumbai 8. ૧૦/સી લાલકાકા બિલ્ડિંગ, મરઝબાન કોલોની, ગીલ્ડર લેન, મુંબઈ ૮. | તે મરલુમો મેહરૂ તથા હોમી અરદેશર ખુશરવશાઈના દીકરા તે એરીક અરદેશર ખુશરવશાઈના બાવાજી તે મેહરનોશ હોમી ખુશરવશાઈ, બેરૂઝ હોમી ખુશરવશાઈ ને અનાઈતા હોમી ખુશરવશાઈના ભાઈ તે રોકશાન મેહરનોશ ખુશરવશાઈ ને મૃદાગી બેરૂઝ ખુશરવશાઈના દેર તે નાશ મેહરનોશ ખુશરવશાઈ, ખુશાલી બેરૂઝ ખુશરવશાઈ ને દીલખુશ બેરૂઝ ખુશરવશાઈના કાકા તે જેનીફર ને રોહીન્ટનના મામા. |
| Soli Nadirshaw Daruwalla સોલી નાદીરશા દારુવાલા | 89 ૮૯ | 10-08-2020 | Ashoka Apartments 'A', 7Th Floor Flat No. 3, Behind Strand Cinema, Colaba, Mumbai 5. અશોકા અપાર્ટમેન્ટ્સ, 'અ', ૭મે માળે, ફ્લેટ નં. ૩, સ્ટ્રેન્ડ સિનેમાની પાછળ, કોલાબા, મુંબઈ ૫. | તે શેરૂ સોલી દારુવાલાના ખાવિંદ તે મરલુમો માનામાઈ તથા નાદીરશાહ કાવસજી દારુવાલાના દીકરા તે ડાપના હોમીયાર ગોઈપોરીયા તથા પરવેઝ સોલી દારુવાલાના બાવાજી તે રોઝી નવલ એન્જનીયર હોશી તથા મરલુમો વિરા, કાલી, રૂસી, પેરીન, બેપ્સી, અદી ને બહેરામના ભાઈ તે તાન્યા, ડેવના, ફરઝાદ ને પીરાનના ગ્રેન્ડ ફાધર તે હોમીયાર બરજોર ગોઈપોરીયા તથા નેન્સી પરવેઝ દારુવાલાના સસરાજી તે મરલુમો કુમી તથા શાવક મેહતાના જમાઈ તે રોશન એરચ મીનબત્તીવાલા ને સામ શાવક મહેતાના બ્રધર ઈન લો. |
| Firoze Ratansha Medhora ફીરોઝ રતનશા મેધોરા | 71 ૭૧ | 10-08-2020 | B-4, Navroz Baug, Lal Baug, Mumbai 12. બી-૪ નવરોઝ બાગ, લાલબાગ, મુંબઈ ૧૨. | તે શીરીન ફીરોઝ મેધોરાના ખાવિંદ તે કાયરસ ફીરોઝ મેધોરાના બાવાજી તે મરલુમો ગુલ તથા હોરમસજી મેધોરાના દીકરા તે શહઝીન ર. કોન્ક્રેટરના સસરાજી તે મરલુમો નાજુ તથા મેરજી ખંબાતાના જમાઈ તે ધનજીશા તથા કાવસ રતનશાહ મેધોરાના ભાઈ. |
| Keki Jamshedji Umrigar કેકી જમશેદજી ઉમરીગર | 88 ૮૮ | 11-08-2020 | Keki House, 164, Bora Bazaar Street, Fort, Mumbai 1. ૧૬૪ બોરા બજાર સ્ટ્રીટ, કેકી હાઉસ, ફોર્ટ, મુંબઈ ૧. | તે નાજુ કેકી ઉમરીગરના ખાવિંદ તે પરવેઝ તથા નીલુફર નોશીર ભીવંડીવાલાના બાવાજી તે મ. પીરોજી તથા જમશેદજી દોરાબજી ઉમરીગરના દીકરા તે ફરીદા તથા નોશીર નરીમાન ભીવંડીવાલાના સસરાજી તે શાહઝાદ, દીલશાદ તથા આરીશના ગ્રેન્ડફાધર તે મ. અદી, મરઝબાન તથા પેરીન મીનુ લવંગીયાના ભાઈ તે મ. દીનામાય તથા ફકીરજી મહેરવાનજી ભરૂચાના જમાઈ તે કાવસ, ખુશરૂ, સામ, મોતી નોશીર દારુવાલા તથા મરલુમો રતિ અરદેસર દારુવાલા, બાનુ મહેરવાનજી સોડોવોટરવાલા તથા મહેરવાનજી ફકીરજી ભરૂચાના બનેવી તે મ. આબાન તથા ખુશરૂ ભરૂચા તથા કુમી નરીમાન ભીવંડીવાલાના વહેવાઈ. |
| Meher Jamshed Shapurji મેહેર જમશેદ શાપુરજી | 83 ૮૩ | 11-08-2020 | B/3, Cusrow Baug, Colaba, Mumbai 39. બી-૩ ખુશરૂબાગ, ચલીદ ભગતસિંગ રોડ, કોલાબા, મુંબઈ ૩૯. | તે મરલુમો આલુ તથા જમશેદ ફરામરોઝ શાપુરજીના દીકરી તે ફીરોઝ જમશેદ શાપુરજીના બહેન તે કેટી ફીરોઝ શાપુરજીના ભાભી તે ઝીનોબયા, ફરાલ ને માલકમના કુઈજી તે ફરામર્ઝ, ફેડી ને સ્નેહલના કુવનસાસુ તે કેવીન, કાર્લ ને ઓરાના ગ્રેની કુઈજી. |
| Yasmin Pestonji Captain યાસમીન પેસ્તનજી કેપ્ટન | 74 ૭૪ | 11-08-2020 | Navab Building, 4th Floor, Wadia Street, Tardeo, Mumbai 34. નવાબ બિલ્ડિંગ, ૪થે માળે, વાડયા સ્ટ્રીટ, તારદેવ, મુંબઈ ૩૪. | તે મરલુમો નગરીશ તથા પેસ્તનજી કેપ્ટનના દીકરી તે દારા પેસ્તનજી કેપ્ટનના બહેન તે મની મીનોચેર ઈચ્છાપોર્યાના કઝીન. |
| Baji Maniksha Belif બજી માણીકશા બેલીફ | 71 ૭૧ | 12-08-2020 | 10, Shivkrupa Sadan, Link Road, Tulshet Pada, Bhandup (West) Mumbai 78. ૧૦, શીવ કૃપા સદન, લેક રોડ, તુલશેટ પાડા, ભાંડુપ (પ.), મુંબઈ ૭૮. | તે મંદા બજી બેલીફના ખાવિંદ તે મરલુમો દીનામાય તથા માણીકશા બેલીફના દીકરા તે મરલુમો આદીલ, ધન તથા દીનયાર બેલીફના ભાઈ તે મરલુમો શગુના તથા ધોંડુરામ નંદગાવકરના જમાઈ. |
| Minoo Tehmurasp Mistry મીનુ તેહમુરસપ મીસ્ત્રી | 79 ૭૯ | 12-08-2020 | Building No.11, 3Rd Floor, Old Khareghat Colony, Hughes Road, Grant Road (W), Mumbai 7. બિલ્ડિંગ નં. ૧૧, ૩જે માળે, ઓલ્ડ ખરેઘાટ કોલોની, હુજસ રોડ, ગ્રાંટ રોડ, મુંબઈ ૭. | તે મરલુમ બચી મીનુ મીસ્ત્રીના ખાવિંદ તે મરલુમો નાજામાય તથા તેહમુરસપ મીસ્ત્રીના દીકરા મરલુમો બાનુ તથા સોરાબજી કેરાવાલાના જમાઈ તે દારા સ. કેરાવાલા, હુતોક્ષી ફ. બેડવાર, બહાદુર સ. કેરાવાલા તથા સુનુ મરેજબાન દારુખાનાવાલાના બનેવી. |

એક નજર પારસી મરણો ઉપર

| Deceased મરનાર | Age વય | Date તારીખ | Address ર. ઠે. | Relations સગાઈઓ |
|--|-----------|---------------|---|--|
| Freny Noshir Daboo ફ્રેની નોશીર દાબુ | 74 ૭૪ | 12-08-2020 | 8, Mandar Chs. Muraraji Ghag Marg, Behind Prabhadevi Temple, Prabhadevi Mumbai 25. ૮, મન્દર સી. એચ. એસ. મુરારી ઘાઘ માર્ગ, પ્રભાદેવી મંદિર પાછળ, પ્રભાદેવી, મુંબઈ ૨૫. | તે નોશીર સોહરાબજી દાબુના ઘણીયાણી તે જુબીન દાબુના બાવાજી તે મરહુમો ગુલામાય ગુલ) તથા દોસાભાઈ (દોસુ) તલાટીના દીકરી તે નાઝનીન જુબીન દાબુના સાસુજી તે સનાયા જુબીન દાબુના અપઈજી તે મરહુમ નેવીલ તલાટીના બહેન તે મરહુમો શીરીનબાઈ તથા સોહરાબજી એદલજી દાબુના વહુ. |
| Rusi Nariman Patel રૂસી નરીમાન પટેલ | 82 ૮૨ | 13-08-2020 | M/30, Nowroz Baug, Lal Baug, Mumbai 12. એમ/૩૦, નવરોઝ બાગ, લાલબાગ, મુંબઈ ૧૨. | તે મરહુમો જાલામાય તથા નરીમાન પટેલના દીકરા તે મરહુમો જહાંગીર ન. પટેલ, તેલમુલ ન. પટેલ, શેરૂ ન. પટેલ તથા કેટી ન. પટેલના ભાઈ તે કેશમીરા તેલમુલ પટેલના દેર તે પરવેઝ તેલમુલ પટેલના કાકાજી તે મહાદ્વજ તથા જીમી મિસ્ત્રીના અંકલ. |
| Parvin Cyrus Panthaky પરવીન સાયરસ પંથકી | 66 ૬૬ | 13-08-2020 | 692, G. S. Chinoy Building 4Th Floor, Flat No.14, Dinshaw Master Road, Dadar, Mumbai 14. ૬૯૨, જીએસ ચીનોઈ બિલ્ડિંગ, ૪થે માળે, ફ્લેટ નં. ૧૪, દીનશાહ માસ્ટર રોડ, દાદર પારસી કોલોની, મુંબઈ ૧૪. | તે સાયરસ દારબશા પંથકીના ઘણીયાણી તે અદી સાયરસ પંથકીના મમા. તે પીનાઝના સાસુ. મહેરનોશ લોશંગજી સંતોકના બહેન તે વહીરતા, ટીયાના અપઈજી તે પરીઝાદ અને મરહુમ પરસી ડુમસીયાના વેવાણ તે મરહુમો નોશીર, મરહુમ આબાન તથા નરગીસના ભાભી તે મરહુમો લોમાય દારબશા પંથકીના વહુ તે મરહુમો સુનામાય લોશંગજી સંતોકના દીકરી. |
| Ervad Cawas Sorab Panthaky એરવદ કાવસ સોરાબજી પંથકી | 71 ૭૧ | 14-08-2020 | Malcom Baug, 6-A, Hongkong House, Jogeshwari (W), Mumbai 102. માલકમબાગ, ૬-એ, હંગકોંગ હાઉસ, જોગેશ્વરી (વે.), મુંબઈ ૧૦૨. | તે એ. કેટી કાવસ પંથકીના ખાવિંદ, તે મરહુમો એ. મેરામાય તથા એ. સોરાબજી પંથકીના દીકરા. તે મરહુમો એ. દોલી તથા એ. મીનોચેર પાવરીના જમાઈ. તે મરહુમો એ. સામ, એ. યજદ ને એ. આદરબાદના ભાઈ તે એ. મરહુમો એદલજી કાવસજી પંથકીના ભત્રીજા. તે મરહુમો બહેરામ, નવરોજ ને સીલ્વુ મીરઝા તથા લોમાય મીરઝા ને રૂસી પંથકી કાકાના દીકરા તે જુબીન સામ પંથકીના કાકા તે મરહુમ જરૂના દેર તે રતનમાઈ રતનજી પંથકીના ભત્રીજા. |
| Khorshed Soli Variava ખોરશેદ સોલી વરીઆવા | 76 ૭૬ | 14-08-2020 | Merwanjee Cama Park Bldg. No. M/4, Flat No.21, Cama Road, Andheri (W), Mumbai 58. એમ૪/૨૧, કામાપાર્ક, કામા રોડ, અંધેરી (વે.), મુંબઈ ૫૮. | તે સોલી ફરામરોઝ વરીઆવાના ઘણીયાણી તે મ. જાલામાય તથા મ. ફરામરોઝ ભગતના દીકરી તે મ. દીનામાય તથા મ. ફરામરોઝ વરીઆવાના વહુ તે ધનજીશાહ, ફેની તથા મ. ડોસાભાઈના ભાભી તે અખ્તાવર, બેપસી, પીલુ, ઝરીન, કેરસી તથા ફિરદોષના કઝીન, તે યજદી, ફિરદોષ, ફરીદા, આદિલ તથા આરતીના કાકીજી તે ફરામરોઝ અને ઈશાનનાં ગ્રાન્ડ કાકીજી. |
| Gulshan Cawas Kanga ગુલશન કાવસ કાંગા | 73 ૭૩ | 14-08-2020 | 5-201, Firozgar, Behram Baug, Parsi Colony, Jogeshwari (W), Mumbai 102. ૫-૨૦૧, ફીરોઝગર, બેહરામ બાગ, પારસી કોલોની, જોગેશ્વરી (વે.), મુંબઈ ૧૦૨. | તે મરહુમો મની તથા એરવદ કાવસ જમશેદજી કાંગાના દીકરી તે ઝરીન કાવસ કાંગા, કેશમીરા દારા સચીનવાલા રૂમી તથા મરહુમ આબાન પરવેઝ તુરેલના બેન તે આઈલીનના નરણ તે સનોબર ને મેહરજાદના માસી તે પ્રશાંત ને ફરઝીનના માસીસાસુ તે મોનીશ, જહાન, જયાનના ગ્રેની તે પેરોઝના કુઈજી. |
| Meherji Manchershah Makati મેહેરજી મંચેરશા મકાતી | 80 ૮૦ | 15-08-2020 | Flat No.6, Bldg. No.2, Tata Colony, Tulsiwadi, Tardeo, Mumbai 34. તાતા કોલોની, ફ્લેટ નં. ૬, બિલ્ડિંગ નં. ૨, તુલસી વાડી, તારદેવ, મુંબઈ ૩૪ | તે લોમાય મેહેરજી મકાતીના ખાવિંદ તે પરીઝાદ લોશંગ રાંદેલ્યાના બાવાજી તે લોશંગના સસરાજી તે દાનેશ ને ચેરાગના મમાવાજી તે મરહુમો બાનુબાઈ તથા મંચેરશા મકાતીના દીકરા તે દારાયસ તથા મરહુમો રૂસી, લોમી, નરગેશના ભાઈ તે સીલ્વુ દારાયસ મકાતીના દેર તે મરહુમો જાલામાય તથા જાલેબર પટેલના જમાઈ તે રોશન તથા મરહુમ જીમી મેઘોરાને રૂબી નોશીર પાઘડીવાલાના બનેવી તે ફરઝાના, જેનીફર ને પરસીના માસાજી તે રૂકશાના, ડેરીના, કેરસી, અરઝેન, ડીકી, કેશમીરા, આરમયતી, જવેર તથા મરહુમો કેરસી, કેરજાદના કાકાજી તે બેરોઝ તથા મરહુમ બરજીસ, અમલસાડીવાલાના મામાજી તે મરહુમો દીનુ તથા જમશેદ રાંદેલ્યાના વેવાઈ. |
| Pesi Darabshaw Dadrewala પેસી દારબશા દાદરેવાલા | 85 ૮૫ | 16-08-2020 | Parukh Dharamshalla, 34 Hughes Road, Old Khareghat Colony, Mumbai 7. પારુખ ધર્મશાળા, ૩૪ હુજીસ રોડ, ઓલ્ડ ખરેઘાટ કોલોની, મુંબઈ ૭. | તે મરહુમો કુવરબાઈ તથા દારબશા દાદરેવાલાના દીકરા તે લોમ્યાર પ. દાદરેવાલા તથા મહાદ્વજ હ. કટકીના બાવાજી તે ઝરીર દાદરેવાલા તથા મરહુમો સાકર, દૌલત, રોશન, ધનજીશા દાદરેવાલાના ભાઈ તે મરહુમો તેલમીના તથા દીનશાજી સુરતીના જમાઈ. |
| Dinaz Dara Driver દીનાઝ દારા ડ્રાઈવર | 71 ૭૧ | 16-08-2020 | Qureshi Mahal, 4th Floor, Flat No-7, Tulsi Pipe Road, Mahim, Mumbai 16. કુરેશી મહલ, ૪થે માળે, ફ્લેટ નં. ૭, તુલસી પાઈપ રોડ, માહિમ, મુંબઈ ૧૬. | તે દારા ડ્રાઈવરના ઘણીયાણી તે મરહુમો રોદા તથા નરીમાન અરદેશીર જશાવાલાના દીકરી તે મરહુમ તનાઝ ડ્રાઈવરના માતાજી તે મરહુમ બકતીયાર જશાવાલા તથા સાયરસ જશાવાલાના બહેન તે મરહુમો અરનાવાઝ તથા ફીરોઝશા ડ્રાઈવરના વહુ તે આવાં સાયરસ જશાવાલા ના નણંદ તે ફેની તથા મરહુમો નોશીર દસ્તુર, ફરોખ ડ્રાઈવરના ભાભી તે પાકઝાદ સાયરસ જસાવાલા તથા નાઝાફીન બહેરામ ગઝદરના કુઈજી તે હોરમઝ નોશીર દસ્તુરના મામીજી. |
| Cyrus Jimmy Pooniwala સાયરસ જીમી પુનીવાલા | 62 ૬૨ | 17-08-2020 | B. Meherwan Building, 'B' Block, Alibhai Preji Marg, Mumbai 7. બી. મેરવાન બિલ્ડિંગ, બી બ્લોક, અલીબાઈ પ્રેમજી માર્ગ, મુંબઈ ૭. | તે ઝીનોબ્યા સાયરસ પુનીવાલાના ખાવિંદ તે મરહુમો આલુ તથા જીમી પુનીવાલાના દીકરા તે મરહુમ મેહેરનોશ જી. પુનીવાલાના ભાઈ તે મરહુમો રોડા તથા નરીમન વાકડયાના જમાઈ. |
| Zarin Bahadurji Dehnugara ઝરીન બહાદુરજી દેહનુગરા | 80 ૮૦ | 18-08-2020 | 7, C/7, Tata Colony, Tardeo, Mumbai 34. ૭સી/૭ તાતા કોલોની, તારદેવ, તુલસીવાડી, મુંબઈ ૩૪. | તે મરહુમો ખોરશેદ તથા બહાદુરજી પ. દેહનુગરાના મોટા દીકરી તે ધનજી દોસાભાઈ પટેલના સાલીજી તે લોશંગ, રોડા, ગોરખી, ધન તથા મરહુમો બરજોર, જમશેદ તથા રૂબીના બહેન તે પરીઝાદ, જેસી, દીકી, શેલનાઝ, યજદી તથા આબાનના માસીજી તે રોશનાઝ અને કુરૂશના કુઈજી તે હુતોક્ષી દેહનુગરાના નણંદ તે મરહુમ રોલીન્ટન મહેતાના સાલીજી. |
| Nozer Jamshed Rana નોઝર જમશેદ રાના | 77 ૭૭ | 18-08-2020 | D/4 - 51, Bharucha Baug, S. V. Road, Andheri (West), Mumbai 58. ડી/૪/૫૧ ભરૂચા બાગ, એસ. વી. રોડ, અંધેરી (વે.), મુંબઈ ૫૮ | તે દોલતના ધની તે ક્યોમઝ ને વીસ્તાસના પપા તે પોરસના ભાઈ તે દાઈના ને જેનીફરના સસરા તે મરહુમો રોશન જમશેદ રાનાના દીકરા તે મરહુમો તેલમીના જાલેબર કેરાવાલાના જમાઈ તે દેલનાઝ અને કેયજાદના કાકા. |
| Katie Dinshaw Jesia કેટી દીનશા જેસીયા | 94 ૯૪ | 18-08-2020 | T-6, Cusrow Baug, Colaba Causeway, Shahid Bhagat Singh Road, Mumbai 1. ટી-૬, ખુશરૂ બાગ, કોલાબા કોલોને, એસ. બી. રોડ, મુંબઈ ૧. | તે મરહુમ દીનશા જે. જેસીયાના વીધવા તે પરવીઝ દ. જેસીયા તથા ફીઝા કે. દાઝવાલાના માતાજી તે મરહુમો ખોરશેદબાનુ તથા મંચેરશા વાચ્છાના દીકરી તે કેરસી એચ. દાઝવાલાના સાસુજી તે ખુશનુમા દાઝવાલા તથા ફરહાદ દાઝવાલાના મમઈજી તે મરહુમો દીનબાઈ તથા જામાજી જેસીયાના વહુ. |
| Aspandiar Sohrab Sidhwa અસપંદીયાર સોહરાબ સીધવા | 82 ૮૨ | 19-08-2020 | Mary Bldg., 2Nd Floor, 264, Dr. Cawasji Hormasji Street, Dhoobi Talao, Mumbai 2. મેરી બિલ્ડિંગ, બીજે માળે, ૨૬૪ ડો. કાવસજી હોરમસજી સ્ટ્રીટ, મુંબઈ ૨. | તે ગુલના ધની. તે દારાયસ ને નવાઝના માસાજી. તે મરહુમો બયામાય સોહરાબ સીધવાના દીકરા. તે મરહુમ ફહીના ભાઈ. તે મરહુમો બાનુબાઈ મીનોચેર ઉનવાલાના જમાઈ. તે કુંવરબાઈ તથા મરહુમ શીરીના કુઈ તે રીશાદ, દેલશાદ, સરોશના માસાજી તે દારા, જરૂ તથા મરહુમ પરવીઝ, રોશન ધનજીશાના બનેવી તે નરીમાન ધનજીશા બલસારાના ભાણેજ. |

એક નજર પારસી મરણો ઉપર

| Deceased મરનાર | Age વય | Date તારીખ | Address ર. કે. | Relations સગાઈઓ |
|---|-----------|---------------|---|---|
| Freny Adi Confectioner ફ્રેની અદી કન્ફેક્શીયનર | 91 ૯૧ | 19-08-2020 | B-6, 3Rd Floor, Cusrow Baug, S.B.S. Road, Colaba, Mumbai 1. બી-૬, ખુશરૂ બાગ, એસ. બી. એસ. રોડ, ત્રીજો માળ, કોલાબા, મુંબઈ ૧. | તે મરલુમ અદી નાદીરશા કન્ફેક્શીયનરના વીધવા તે મરલુમો શીરીનબાઈ તથા જલંગીરજી કન્ફેક્શીયનરના દીકરી તે મરલુમો અદી, રોશન તથા સોરાબના બહેન તે મરલુમો ધન તથા નાદીરશા કન્ફેક્શીયનરના વલુ તે મરલુમ પરવીજ તથા ધનના નરન તે ઝરીર, શ્યાવક, દારાયસ તથા વીરાના આન્ટી. |
| Shera Firoz Dibara શેરા ફીરોઝ દીબારા | 80 ૮૦ | 19-08-2020 | Doctor building, 4th floor, Shapoorji Bharucha Baug, Andheri (West), Mumbai 58. ડોક્ટર બિલ્ડિંગ, ૪થો માળ, શાપુરજી ભરૂચા બાગ, અંધેરી (વેસ્ટ) મુંબઈ ૫૮. | તે મરલુમો રોદા ફિરોઝ દીબારાના દીકરી તે મરલુમો મરઝબાન, દિન્યાર, ખોરશેદ ને મનીના બહેન. |

Death Announcements from Mumbai Bandra

| | | | | |
|-------------------------------|----------|------------|---|---|
| Nargis Marker નરગીસ માર્કર | 86 ૮૬ | 02.08.2020 | Charlesville, Almeida Park, 5th Road, Bandra (West), Mumbai 50. ચાર્લ્સ વીલે, અલમેડા પાર્ક, ૫મે માલે, બાન્દ્રા વેસ્ટ, મુંબઈ ૫૦. | તે સુલ્મ ફરીદુન માર્કરના ઘણીયાણી તે ફીઝી સુલ્મ માર્કર ના મમ્મી તે મરલુમ ખોરશેદ અને ફરામરોઝ કેપ્ટન ના દીકરી. |
|-------------------------------|----------|------------|---|---|

Death Announcements from Prayer Hall

| | | | | |
|---|----------|------------|---|---|
| Farokh Jahangir Pastakia ફરોખ જહાંગીર પસ્તાકીયા | 73 ૭૩ | 05.08.2020 | 722/6-A- Meher Building Parsi Colony, Dadar East, Mumbai 14. ૭૨૨/ ૬-એ મહેર બિલ્ડિંગ, પારસી કોલોની, દાદર, ઈસ્ટ, મુંબઈ ૧૪. | તે મહાઝબના ઘણી તે મરલુમ જરબાઈ તથા મરલુમ જલંગીરના દીકરા તે બેહનાઝ, બીનાયફર, ફરહાદના પપ્પા તે પેરીન, મરલુમ મીનુ, ફલી, મહેરૂના ભાઈ તે ગોવિંદ, ઝુબીનના સસરા તે મરલુમ ઝારા, સાક્ષી, કરીશ્મા, લુક્ષિયા અને ફરઝાનના ગ્રાન્ડ ફાધર તે હોશંગ, રોશન, પરવેઝ, બેરોઝ, ખુરશીદ, મરલુમ નેલીના બ્રધર ઈન લો. |
| Aspi Byramji Sutaria અસ્પી બાયરામજી સુતરીયા | 77 ૭૭ | 06.08.2020 | Hilla Garden View, 5th Floor, 5th Floor, 662, Sohrab Palankot Road, Near Wadala Market, Dadar East, Mumbai 14. હિલા ગાર્ડન વ્યુ, ૫મે માળે, ૬૬૨, સોહરાબ પાલમકોટ રોડ, વડાલા માર્કેટ નજીક, દાદર (ઈ), મુંબઈ ૧૪. | તે આલુના ઘણી તે કેશ્મીરા અને ખુશનુમાના પપ્પા તે મરલુમ જરબાઈ તથા બાયરામજીના દીકરા તે રોશન, મરલુમ ફેની અને મરલુમ ખોરશેદના ભાઈ તે મરલુમ જર અને મરલુમ રૂસી શ્રોફના જમાઈ તે દીનુ, બોમી અને જલંગીરના બ્રધર ઈન લો. |
| Rustomji Kaikhushru Kappawala રૂસ્તમજી કેખુશરૂ કપ્પાવાલા | 86 ૮૬ | 11.08.2020 | Building No 11, Room No. 1, Tata Colony, Tardeo Mumbai 34. બિલ્ડિંગ નં. ૧૧, રૂમ નં. ૧, તાતા કોલોની, તારદેવ, મુંબઈ ૩૪. | તે મરલુમ નાજમાય અને મરલુમ કેખુશરૂના દીકરા તે પીલુના ઘણી તે મરલુમ શેરબાનુના ભાઈ તે વિરાના પપ્પા તે ડીકીના સસરા તે બરજીસના ગ્રાન્ડ ફાધર તે વિસ્પીના અંકલ. |
| Homai Behram Mistry હોમાય બહેરામ મીસ્ત્રી | 84 ૮૪ | 10.08.2020 | 805, Tehmi Terrace, Flat, 5/3, Dr. Ambedkar Road, Dadar, Mumbai 14. ૮૦૫, તેહમી ટેરેસ, ફ્લેટ, ૫/૩. ડૉ. આંબેડકર રોડ, દાદર, મુંબઈ ૧૪. | તે મરલુમ ગુલબાનુ તથા મરલુમ શાવકશા પાઘડીવાલાના દીકરી તે મરલુમ બહેરામના ઘણીયાણી તે ખુરશીદના મમ્મી તે શ્રેટુન પટેલના સાસુજી તે કેજીન આરબુમન ઈરાની અને વરઝાનના ગ્રાન્ડ મધર તે ઝાયરા અને લીયાનાના ગ્રેટ ગ્રાન્ડ મધર. |
| Nariman Darabshah Khan નરીમાન દારબશા ખાન | 66 ૬૬ | 16.08.2020 | 6, 3A Sonawala Building, Tardeo, Mumbai 7. ૬, ૩એ સોનાવાલા બિલ્ડિંગ, તારદેવ, મુંબઈ ૭. | તે મરલુમ શીરીન તથા દારબશા ખાનના દીકરા તે મરલુમ હીરા તથા હોમી મીસ્ત્રીના જમાઈ તે યારમીન નરીમાન ખાનના ઘણી તે સાયરસ ખાનના પપ્પા તે અરનાઝ ભેસાનીયા અને પરવીઝ ઈરાનીના ભાઈ તે કયોમર્ઝ મીસ્ત્રીના બ્રધર ઈન લો, તે બેહઝાદ, અનાહિતા, ફિરદોશ, પરિઝાદના અંકલ. |

Death Announcements from Navsari

| | | | | |
|--|----------|------------|--|---|
| Cawas Kekhashro Tantra કાવસ કેખશરૂ તાંતરા | 91 ૯૧ | 15.08.2020 | The WZO Trust Funds Senior Citizen Centre. ધ ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ સિનિયર સિટીઝન સેન્ટર. | તે મરલુમ કેખશરૂ બહેરામ તાંતરા તથા મરલુમ બાનુબાઈ કેખશરૂ તાંતરાના દીકરા |
|--|----------|------------|--|---|

Death Announcements from Mumbai

| | | | | |
|---|----------|------------|--|--|
| Faredun Homi Kalagopi ફરેદુન હોમી કાલાગોપી | 67 ૬૭ | 14.08.2020 | The WZO Trust Funds Senior Citizen Centre. ધ ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ સિનિયર સિટીઝન સેન્ટર. | તે મરલુમ હોમી કાલાગોપી તથા મરલુમ શેહરા હોમી કાલાગોપીના દીકરા તે કાશ્મીરા સોલી લેન્ટીન અને સામ નરીમાન ઉડવાડીયાના કઝીન તે મરલુમ ધનજીશા કાવસજી કાલાગોપી તથા મરલુમ ધનમાય ધનજીશા કાલાગોપીના ભત્રીજા તે મરલુમ નરીમાન પેસ્તનજી ઉડવાડીયા તથા મરલુમ ધનમાય નરીમાન ઉડવાડીયાના ભાણેજ તે સામ દીનશાજી કાલાગોપીના ભાઈ. મહાઝબ સામ કાલાગોપી-સીસ્ટર ઈન લો, ધન પોરસ વક્તુર-ડીયરેસ્ટ |
|---|----------|------------|--|--|

Death Announcements from USA

| | | | | |
|--|----------|------------|------------|---|
| Ava Jehangir Kharas આવાં જહાંગીર ખરાસ | 94 ૯૪ | 18.08.2020 | USA. યુએસએ | તે જહાંગીર પિરોઝશા ખરાસના ઘણીયાણી તે ધનમાય અને રૂસ્તમજી સચિનવાલાના દીકરી તે ફરામરોઝ ખુરશેદચેર, મિનોચર, દિનશા અને નોશીરવાનના બહેન તે જમશેદ અને ખુશરૂ, હિરાના મમ્મી અને એલેક્સિસ ના સાસુજી. |
|--|----------|------------|------------|---|

લોકડાઉનમાં શું આપણી મમ્મીને આરામ મળ્યો છે?

એક સ્ત્રીને જ્યારે યમ રાજા લેવા આવે છે તો એ શું કહે છે? 'ચાલો,' 'તમે કોણ?' 'યમરાજ...તમારો સમય અહીં પૂરો થયો.' 'ઓહ...આમ...આમ...અચાનક તમે મને ના લઈ જઈ શકો.' 'કેમ? હજુય લાલચ નથી છૂટતી જીવવાની!'

'એવું નથી સાહેબ...વધારે નહીં, માત્ર એક દિવસ આપો મને. કાલે આ જ ટાઈમે લઈ જાઓ બસ...માત્ર ચોવીસ કલાક.' 'એવું તો શું કરી લેવું છે આ ચોવીસ કલાકમાં?' 'જી..મારે હજુ રસોઈ બાકી છે. સાંજે મહેમાન આવે છે..એમને સાચવવાના છે. મારો કબાટ અસ્ત-વ્યસ્ત છે, જરાક સરખું ગોઠવી લઉં. મને જ લપેટવા કોરા કપડાં જોઈશે..તો તરત મળી રહે.'

'કાલે જ દીકરાને મારા લાથની પુરી ખાવાનું મન થયેલું, એકાદ ડબ્બો ભરી લઉં, ચાલશે એને, ઘઉં દળાવવા મુકેલા છે, એ આજે લેતી આવું. મવાઈનો બાઉલ ભરાઈ ગયો છે, ઘી કાઢી લઉં જરા. ચાદરો સારી પાથરી દઉં, કેટલાય આવશે! અને હા..ઉઘડતી સૂલે બાળકોના નવા સૂલ લેસ લાવવાના છે, થોડા વહેલા જ લઈ આવું. પછી ફિટિંગની માથાકૂટ જ નહીં. દીકરીના વાળ કપાવતી આવું, જાતે ઓળી તો શકે. થોડુંક કરિયાણું

ભરી જ લઉં. દસેક પેકેટ મેગીના લેતી આવું, મારા વગર સોરાતા બાળકો કદાચ એ તો ખાયા! ને. હા..થોડો સમય એ રીતે એડજસ્ટ કરજો પ્લીઝ કે મારા બધા બાળકો મારી સામે જ હોય. ધરાઈને એમને જોઈ લઉં એટલે પછી એક દુ:ખ ના રહે કે છેલ્લે મળાયું નહીં. 'તમે છો કોણ? આ પૃથ્વી પર ક્યા નામ- સ્વરૂપથી જાણીતા છો?' 'જી હું મા છું. આ તો તમે શોર્ટ નોટિસ આપી એટલે, નહીંતર બીજા ઘણાંય કામ છે. પણ હવે તમારી સામે કોઈનુંય

ક્યાં ચાલ્યું છે!' 'માફ કરશો..મારુ કામકાજ જ એવું છે કે લાગણી શબ્દની સમજણ જ નહોતી. હું તો સ્ત્રી/મા એટલે માત્ર હરતું-ફરતું શરીર જ ધ્યાનમાં રાખતો..પણ એમાં ઠાંસી ઠાંસીને આટલો પ્રેમ હોય એવી તો ખબર જ ક્યાં! તમારી જરૂર અહીં નીચે વધારે છે. થોડુંક કાળું-ધોળું બધે જ ચાલતું હોય. તમે જલસા કરો, હું કોઈ વેન્ટિલેટર પાસે પહોંચી જાઉં.



થેન્ક્યુ ભગવાન, તારો આભાર

શીરીનને એક અજબ ટેવ હતી કે જે મોટાભાગે લગભગ કોઈ કોઈને હોય છે જે છે ડાયરી લખવાની આદત. શીરીનને એવી ટેવ હતી કે દરરોજ સુતા પહેલા પોતાની આખા દિવસની ખુશાલીઓ અને પોતાના દુઃખ એક ડાયરીમાં લખી લેતી હતી.

દિવસમાં ગમે તેટલું કામ કર્યું હોય દિવસમાં ગમે તેટલી દોડાદોડી કરી હોય અને દિવસ દરમિયાન ગમે તેટલા થાકી ગયા હોય તો પણ દિવસ દરમિયાન જે પણ કોઈ ખુશીની પળો મળી હોય લખવા કોઈ મન દુઃખ થયું હોય તો તે દરરોજ પોતાની ડાયરીમાં લખી લેતી.

એક રાતની આ વાત છે, ઘડિયાળમાં અંદાજે બાર વાગી રહ્યા હતા. રૂમની ખુલ્લી બારીમાંથી ચંદ્રમાનો પ્રકાશ ધીમે ધીમે રૂમમાં પ્રવેશી રહ્યો હતો. શીરીન ઘરના બધાજ કામમાંથી પરવારી પોતાના રૂમમાં પ્રવેશી તેનો ઘણી કદાચ ક્યારનો સુઈ ગયો હતો. તેની ઉપર પ્રેમ ભરી

નજર કરી તેના બેડની બાજુમાં રહેલા ખાના પાસે જાય છે ખાનું ખોલી ને તેમાંથી એક ડાયરી કાઢે છે.

અને ડાયરી લખવાનું શરૂ કરે છે.

શીરીને લખ્યું હું ખુશ છું કે મારા પતિ મારા બેડરૂમમાં આવ્યા પહેલાજ સુઈ જાય છે, કારણ તે ઓફિસમાં ભરપૂર કામ કરે છે. અને જેનાથી માંડે આંખું ઘર ચાલે છે. થેન્ક્યુ ભગવાન, તારો આભાર.



ડાયરીમાં બીજો ઉમેરો કરે છે. હું ખુશ છું કે મારો દીકરો સવારમાં એ વાત પર ઝઘડો કરે છે કે આખી રાત મચ્છરોએ તેને સુવા નથી દીધો. એનો મતલબ કે તે આખી રાત ઘરે વિતાવે છે બહાર જઈને નથી ઉડાવતો થેન્ક્યુ ભગવાન, તારો આભાર.

હું ખુશ છું કે દરેક મહિને ઈલેક્ટ્રિસિટી

ગેસ પેટ્રોલ વગેરે પર સારો એવો ટેક્સ દેવો પડે છે, એનો મતલબ કે મારી પાસે બધી વસ્તુઓ છે અને હું તેનો ઉપયોગ કરી રહી છું. જો આ વસ્તુઓ મારી પાસે ન હોત તો જિંદગી કેટલી મુસીબત વાળી હોત? થેન્ક્યુ ભગવાન, તારો આભાર.

હું ખુશ છું કે દર વર્ષે નવરોઝ અને નવા સાલ બર ભેટ-સોગાદો ખરીદવામાં મારું પર્સ ખાલી થઈ જાય છે, એનો મતલબ કે મારી પાસે પ્રેમ કરવાવાળા, મારા મિત્રો, મારા સગા સંબંધીઓ, મારા પોતાના એવા ઘણા લોકો છે જેને હું ભેટ આપી શકું. જો આ લોકો કોઈ જિંદગીમાં જ ન હોય. તો જિંદગીમાં રોનક શું રહે? થેન્ક્યુ ભગવાન, તારો આભાર.

હું ખુશ છું કે દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં હું કામ કરીને ખૂબ થાકી જાઉં છું અને છતાં આ ડાયરી લખું છું એટલે કે મારામાં આખા દિવસ દરમિયાન સખત કામ કરવાની તાકાત અને હિંમત છે અહુરામઝદા તારી કૃપા આ ફક્ત તું જ કરી શકે છે. થેન્ક્યુ ભગવાન, તારો આભાર.

હું ખુશ છું કે દરરોજ અલામનો અવાજ આવે કે તરત જ હું જાગી જાય

ખોરદાદ સાલ મુબારક

ઓ પ્યારા પૈગામ્બર, હોજો તમને સાલ મુબારક

તમેજ છો, અમો સર્વ ના માર્ગ ચિંધનાર, અમારા તારક.

અહુરાના છો તમે મોકલાવેલા રાહરાહબર, અગત્ય ના કારક.

ભલે પધાર્યા અમારે આંગણે, આપવા અમને ઉત્તમ કેળવણી,

સિખવ્યુ જીવવાનું અમને, કેમ મનશનિ, ગવશની, કુનશની વણી.

છો તમે, દાદારે મોકલેલું એક અણમોલ રતન, બહુમુલ્ય મણિ.

ગાઈએ એટલેજ અમે, સદા અહુરાના, અને તમારા ગુણગાન.

કોમને છે એક સાચા રાહબરની જરૂરત, કરો એ પુરી, ઓ ઝરથુશ્ત્ર મહાન

ઓ વશુરએ વશુરાન, તમારામાં વસે છે તમારી આખી કોમ નિ જાન.

- આફ્રીદ દસ્તુર

હું, એટલે કે મને દરરોજ એક આખો દિવસ ભેંટમાં મળે છે. થેન્ક્યુ ભગવાન, તારો આભાર.

ખુશ છું કે દરરોજ મારે મારા ઘરને સાફ કરીને ઝાડું પોતા કરવા પડે છે અને દરવાજા તેમજ બારીઓને પણ સાફ કરવી પડે છે. સારું છે મારી પાસે ઘર તો છે જે લોકો પાસે રહેવા માટે છત નથી તેનો શું હાલ થતો હશે? થેન્ક્યુ ભગવાન, તારો આભાર.

હું ખુશ છું કે ક્યારેક ક્યારેક હું થોડી બીમાર પડી જાય છું, એટલે કે મારી તબિયત મોટા ભાગે સારી જ રહે છે. થેન્ક્યુ ભગવાન, તારો આભાર.

આટલું જ નહીં શીરીને ડાયરીમાં ઘણું બધું લખ્યું અને વાતના અંતમાં તે થેન્ક્યુ ભગવાન, તારો આભાર જરૂર લખતી.

આટલું લખીને ડાયરી તેણે પાછી સાચવીને ડ્રોવરમાં મૂકી દીધી, આ કદાચ એક અજબ વાત પણ લાગે.

પરંતુ જો જીવવાના આ કોમર્સુલા ઉપર આપણે અમલ કરીએ તો, આપણી અને આપણા લોકોની જિંદગી જીવવાની મજા વધી જશે. તમે દરેક સારી પળ માટે ભગવાનનો આભાર માની શકો છો. આપણે દરેક નાની-મોટી સમસ્યાઓમાં જિંદગી પ્રત્યે ગુસ્સો કરતા હોઈએ છીએ નાની બાબતમાં પરેશાન થતાં હોઈએ છીએ ભગવાનનો વાંક કાઢતા હોઈએ છીએ. પરંતુ આપણે આપણા જીવનમાં થોડોક બદલાવ લાવીએ તમે ભગવાનને કમ્પલેન્ટ કરવાના બદલે એકવાર તેનો આભાર તો માની જુઓ ખરેખર તમારી જિંદગી બદલાઈ જશે.

કરોના સમયમાં શીખેલા પાઠ

અસંખ્ય કિંમતી અનુભવો લીધા છે. આપણે ગભરાટ, ખોટ, કંટાળો અને ડરનો અનુભવ કર્યો છે. પરંતુ આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગરૂકતા ઉભી થઈ છે. આપણે આપણા ઘરોમાં



એકલતા, સામાજિક રીતે વંચિત, છીએ અને પ્રાર્થના કરી આશા રાખીએ છીએ. આપણે બધા હતાશા અને લાચારીની ભાવનાઓથી ઘેરાયેલા છીએ. આ રોગચાળામાં વધુ સારું થાય તે પહેલાં તે બધું વધારે ખરાબ થઈ રહ્યું છે. હવે છેલ્લા બે મહિનામાં આપણે શીખ્યા છીએ કે, 'સલામત રહો અને સમજદાર બનો.' 'આ પણ સમય પસાર થઈ જશે.' - આપણે આપણને કહેતા રહીએ છીએ. સત્ય એ છે કે, જ્યારે આપણે બહારથી ઘણું ગુમાવીએ છીએ, ત્યારે આપણને

અંદરથી પકડવાની એક તક ઈશ્વર આપે છે!

સ્વાસ્થ્ય અને સુખાકારી બધાથી ઉપર: કોવિડે આરોગ્ય અને તંદુરસ્તી અંગેના અમારા મતને નવી વ્યાખ્યા આપી છે.

આપણે તંદુરસ્ત ટેવો અને સામાન્ય રીતે તંદુરસ્ત જીવન શૈલીના વિકાસના મહત્વને વધુ ધ્યાન આપી રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ. પોતાને શરીર, મન અને ભાવનાની સંભાળ રાખવી એ અગ્રતા બની છે. શારીરિક રીતે તંદુરસ્ત અને માનસિક રીતે પડકારજનક રહેવું એ આજકાલનો ક્રમ બની ગયો છે.

આપણે આપણા ગ્રહ સાથે સહ-અસ્તિત્વમાં રહેવાની જરૂર છે: સંભવત અત્યાર સુધીનો સૌથી મહત્વપૂર્ણ પાઠ, અને આપણને યાદ રાખવાની જરૂર છે, કે આપણને ગ્રહની જરૂરત છે ગ્રહને આપણી જરૂરત નથી. આપણે આપણા ગ્રહની કદર કરવાની જરૂર છે. તમે જે

જમીન પર રહો છો તેનો આદર કરો.

સંબંધોને પ્રાધાન્ય આપવું: આપણા આસપાસના સંબંધો માટે સમય કાઢવો જરૂરી છે. આપણા આસપાસના મિત્રો અને કુટુંબીજનોની પ્રશંસા કરવાનો આ સમય છે. આ સમય સંબંધોને ફરીથી બનાવવાની તક આપી રહ્યો છે.

બચત અને કટોકટી ભંડોળનું મહત્વ: બેરોજગારી, નોકરીમાં કાપ અને પગારના કાપ સાથે, આપણે બચાવવાનું મહત્વ સમજી લીધું છે! આ આર્થિક મંદી આપણા ખર્ચ અને બચત પર કાયમી ડાઘ છોડી જશે.

ઉપભોક્તાના યુગને અલવિદા કહેતા: આપણે અનુભવીએ છીએ કે આપણે ખરેખર જેટલું ખર્ચું તેટલું ખર્ચ કરવાની જરૂર નહોતી. આપણે ખરીદીઓ કરી હતી અને એમ લાગતું હતું તેના વગર જીવવું મુશ્કેલ છે પરંતુ લોકડાઉન હેઠળ, આપણે ઘણી વસ્તુઓ પર એક નવો દ્રષ્ટિકોણ મેળવ્યો છે. આશા છે કે, આ સમયગાળાએ આપણને બતાવ્યું છે જે આપણી પાસે છે તે પૂરતું છે, અને આપણે તેના માટે આભારી થવાની જરૂર છે!

ચાલો ધીમા પડીએ: આપણે સતત એવી જ દુનિયામાં જીવી રહ્યા હતા જે

એક રેસ સમાન હતી. વધુ સાફ મેળવવા આપણે સ્પર્ધા કરવા અને સફળ થવા સતત દબાણ હેઠળ જીવન જીવતા હતા. પરંતુ હવે ધીમા પડવાની જરૂર છે. આપણા જીવનમાં આ નવો અધ્યાય સભાન પ્રવેશ સાબિત થયો છે. કદાચ હવે આપણે ભવિષ્ય વિશે વધુ પડતા ચિંતા કર્યા વિના ખરેખર જીવવાનું શીખીશું. છેવટે, 'જીવનની મજા માણવી હોય તો દરેક ક્ષણનો આનંદ માણવો જરૂરી છે!'

જ્યારે બધા નિષ્ફળ થાય છે, ત્યારે જીવંત હોય છે આશા: કટોકટીએ આપણને જે શીખવ્યું છે તે આશા પર જીવવાનું છે. આજે, આખું વિશ્વ આશાને વળગી રહ્યું છે. જો કોઈ એવી વસ્તુ છે જે આપણને તરંગી અને સમજદાર રાખે છે, તો તે આશા છે કે આપણે લગભગ તે ઉપાયની આરે છે જે આપણા જીવનને સામાન્યતાના પ્રવાહમાં પાછું લાવી શકે. માનવ આશા હંમેશાં એક એવી વસ્તુ રહી છે જે કોઈપણ સંભાવનાને જીવંત રાખે છે. આ સમયએ ખરેખર આપણને શીખવ્યું છે: 'ડર કરતા આશા એકમાત્ર શક્તિશાળી છે!'

-વીરાં શ્રોફ સંજાણા



YOUR MOONSIGNS JANAM RASHI THIS WEEK

લખનાર: મરહુમ મહારાજ શ્રી સ્વયંજયોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

અઠવાડિક રાશિક્ષણ: તા. ૨૨.૦૮.૨૦૨૦ થી તા. ૨૮.૦૮.૨૦૨૦



Aries - મેષ - અ.લ.ઈ.

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. મીઠી જબાન વાપરી બીજાના દિલ જીતી લેશો. તમારા અટકેલા કામ કરી પાછા ચાલુ કરી શકશો. નાણાકીય બાબતમાં ભયત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. જૂના ઈનવેસ્ટમેન્ટમાંથી લાભ મળશે. મિત્રોથી ફાયદો મેળવી શકશો. દરરોજ 'મહેર નીઆએશ' ભણજો. શુકનવંતી તા. ૨૨, ૨૩, ૨૪, ૨૮ છે.

Lucky Dates: 22, 23, 24, 28.

Mercury's ongoing rule helps you to take on all your challenging tasks with ease and efficiency. You will be able to win over the hearts of others with your sweet words. You will be able to restart your stalled projects. Ensure to make financial investments. You will profit from old investments. Your friends will prove beneficial. Pray the Meher Nyaish daily.



Cancer - કર્ક - ડ.હ.

તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી દરેક પ્રકારના લાભ મળતા રહેશે. તમારા મનને શાંત રાખીને આગળ વધી શકશો. નાની મુસાફરી કરી શકશો. પ્રમોશન મળવાના ચાન્સ છે. ઘરનું વાતાવરણ સારું રાખવા ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરજો. લેતી-દેતીના કામો સમય પર પૂરા કરી શકશો. દરરોજ ૩૪મું નામ 'યા બેસ્તરના' ૧૦૧વાર ભણજો. શુકનવંતી તા. ૨૩, ૨૪, ૨૫, ૨૬ છે.

Lucky Dates: 23, 24, 25, 26.

The ongoing Moon's rule brings you all kinds of benefits. You will be able to progress ahead with a calm mind. Short travels are indicated. You could be up for a promotion! To keep the home atmosphere cordial, do cater to the needs of family members. You will be able to complete any lending-borrowing transactions on time. Pray the 34th Name, 'Ya Beshtarna', 101 times, daily.



Libra - તુલા - ર.ત.

શુકની દિનદશા ચાલુ હોવાથી બધાજ કામો સારી રીતે કરી શકશો. તમારા કરેલા કામની કદર થશે અને ફાયદો પણ થશે. ખર્ચ પર કાબુ નહીં રહે પરંતુ નાણાકીય મુશ્કેલી નહીં આવે. જોઈતી ચીજ વસ્તુ લેવામાં મુશ્કેલી નહીં આવે. ઓપોઝીટ સેક્સ સાથે સારા સારી રહેશે. દરરોજ 'બહેરામ યઝદ'ની આરાધના કરજો. શુકનવંતી તા. ૨૩, ૨૪, ૨૬, ૨૭ છે.

Lucky Dates: 23, 24, 26, 27.

Venus' ongoing rule helps you do all your chores smoothly. Your work will receive appreciation as well as profits. Despite your inability to control your expenditures, there will be no financial challenges. You will be able to make purchases of your choice. Your equation with the opposite gender will flourish. Pray to Behram Yazad daily.



Capricorn - મકર - ખ.જ.

૨૪મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથેથી જાણતા અજાણતા ચેરીટીના કામો થઈ જશે. બીજાને મદદ કરી શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. દરેક કામમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જવાથી કામો સરળતાથી પૂરા કરી શકશો. વડીલવર્ગની તબિયત સારી રહેશે તેમની સેવા કરી શકશો. દરરોજ 'સરોશ યશ્ત' ભણજો. શુકનવંતી તા. ૨૪, ૨૫, ૨૬, ૨૭ છે.

Lucky Dates: 24, 25, 26, 27.

Jupiter's rule till 24th September will lead you towards doing charity, advertently or inadvertently. You will be able to help others. Financial stability is indicated. You will receive anonymous help in everything you do, thus you will be able to complete your work easily and effectively. Elders will be fine - you will be able to be of service to them. Pray the Sarosh Yasht daily.



Taurus - વૃષભ - બ.વ.ઉ.

પહેલા ત્રણ દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી મંગળની દિનદશા એક્સીડન્ટ કરાવી શકે છે માટે વાહન સંભાળી ચલાવજો. ૨૫મીથી શરૂ થતી બુધની દિનદશા તમારા બધા દુઃખ દૂર કરી આપશે. તમારાથી થયેલી ભૂલને શોધી તમે તેનું નિરાકરણ કરશો. નાણાકીય બાબતમાં સુધારો થતો જશે. કોઈ સારા સમાચાર મળશે. હાલમાં 'તીર યશ્ત' સાથે 'મહેર નીઆએશ' ભણજો. શુકનવંતી તા. ૨૫, ૨૬, ૨૭, ૨૮ છે.

Lucky Dates: 25, 26, 27, 28.

With the last three days remaining under the rule of Mars, you need to ride/drive your vehicles very cautiously as the descending rule of Mars could likely cause accidents. Mercury's rule starting from the 25th will ease all your issues. You will be able redeem and correct any mistakes that you have made. Your financial situation will improve. You could receive good news. Pray the Meher Nyaish along with the Tir Yasht daily.



Leo - સિંહ - મ.૨.

સુર્યની દિનદશા ચાલુ હોવાથી દક્ષી સપ્ટેમ્બર સુધી સુર્ય તમને ખૂબ તપાવશે. નાની બાબતમાં તમને ગુસ્સો આવશે. તમારી સાથે કામ કરનાર પણ તમને પરેશાન કરશે. ઘણી-ઘણીયાણીમાં મતભેદ પડતા રહેશે. આવકની જગ્યાએ જાવક વધી જશે. સરકારી કામ કરતા નહીં. ૯૬મું નામ 'યા રયોમંદ' ૧૦૧ વાર ભણજો. શુકનવંતી તા. ૨૨, ૨૩, ૨૭, ૨૮ છે.

Lucky Dates: 22, 23, 27, 28.

The Sun's ongoing rule till 6th September will cause you discomfort. You could end up getting angry over small matters. Your colleagues could trouble you. Frequent squabbles between couples could take place. Your outgoings will be more than your income. Avoid doing any government related work. Pray 96th Name, 'Ya Rayomand', 101 times, daily.



Scorpio - વૃશ્ચિક - ન.પ.

દક્ષી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી નાની બાબતમાં પરેશાન થશો. તબિયતની ખાસ સંભાળ લેજો. તબિયતની બેદરકારી તમને મોટી મુશ્કેલીમાં મુકશે. બીજાને મદદ કરવા જતા તમે પરેશાન થશો. નાણાકીય બાબતમાં પરેશાન થશો. રોજબરોજના કામમાં મુશ્કેલીઓ આવશે. ઘરવાળાનો સાથ સહકાર નહીં મળતા દુઃખી થશો. ભુલ્યા વગર દરરોજ 'મહાબોખ્તાર નીઆએશ' ભણજો. શુકનવંતી તા. ૨૨, ૨૩, ૨૫, ૨૯ છે.

Lucky Dates: 22, 23, 25, 29.

Rahu's rule till 6th September could pose challenges even in petty matters. Ensure to take good care of your health as your carelessness could cause a huge health-issue. Your effort to help others will end up with you getting into trouble. Financially, you will feel stressed. Doing your daily chores will also seem difficult. The lack of support from family members will distress you. Pray the Mah Bokhtar Nyaish daily.



Aquarius - કુંભ - ગ.શ.સ.

આવતા ચાર દિવસજ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તબિયતની સંભાળ રાખજો. ઉતરતી શનિની દિનદશા તબિયત ખરાબ કરશે. વડિલવર્ગની ચિંતા ખુબ વધી જશે. ઈલેક્ટ્રીકિટીનો સામાન લેતા નહીં. ૨૬મીથી શરૂ થતી ગુરૂની દિનદશા તમારા દરેક કામ સરળ બનાવશે. ધર્મના કામો કરવામાં સફળતા મળશે. દરરોજ 'મોટી હમન યશ્ત' સાથે 'સરોશ યશ્ત' ભણજો. શુકનવંતી તા. ૨૨, ૨૩, ૨૫, ૨૭ છે.

Lucky Dates: 22, 23, 25, 27.

With Saturn's rule lasting another four days, ensure to take care of your health as the descending rule of Saturn could take a toll on your wellbeing. The elderly could be a cause for concern. Avoid making any purchases related to the usage of electricity. Jupiter's rule starting from the 26th will ease all your work for you. You will succeed in doing religious works. Pray the Sarosh Yasht along with the Moti Haptan Yasht daily.



Gemini - મિથુન - ક.છ.ધ.

૨૫મી સુધી ચંદ્રની દિનદશા ચાલશે જોઈતી ચીજ વસ્તુ પહેલાજ ઘરમાં વસાવી લેજો. ૨૬મીથી શરૂ થતી મંગળની દિનદશા તમારા સ્વભાવમાં મોટા ચેન્જસ આવશે. તમારો ગુસ્સો વધતો જશે. મંગળની દિનદશા ચાલુ થતા વાતાવરણમાં શાંતિ નહીં રહે. ઘણી-ઘણીયાણીમાં મતભેદ પડવા લાગશે. દરરોજ ૩૪મું નામ 'યા બેસ્તરના' સાથે 'તીર યશ્ત' ભણજો. શુકનવંતી તા. ૨૨, ૨૩, ૨૪, ૨૭ છે.

Lucky Dates: 22, 23, 24, 27.

The Moon's rule till 25th suggests that you make any house purchases first. Mars' rule starting 26th could cause you to have mood swings and change in behaviour. You could feel angrier. The onset of Mars' rule will take away the peace from your surroundings. Couples could end up squabbling. Pray the 34th Name, 'Ya Beshtarna', along with the Tir Yasht daily.



Virgo - કન્યા - પ.ઠ.ણ.

૧૬મી સપ્ટેમ્બર સુધી શુકની દિનદશા ચાલુ હોવાથી કામ કરવામાં કંટાળો નહીં આવે. ભવિષ્યમાં નાણાકીય મુશ્કેલી નહીં આવે તે માટે ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. સેલ્ફકોન્ફીડન્સ સારો હોવાથી કામ સરખી રીતે કરી શકશો. ધનલાભ મળતા રહેશે. ચાલુ કામ પર ધ્યાન આપજો. દરરોજ 'બહેરામ યઝદ'ની આરાધના કરજો. શુકનવંતી તા. ૨૨, ૨૩, ૨૫, ૨૬ છે.

Lucky Dates: 22, 23, 25, 26.

Venus' rule till 16th September takes away any lethargy related to your working. To avoid financial challenges in the future, ensure to invest money. Your high self-confidence enables you to work well and effectively. You will continue to gain profits. Focus on your ongoing work. Pray to Behram Yazad daily.



Sagittarius - ધન - ભ.ધ.ફ.

આજ અને કાલનો દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાનો છે. બે દિવસમાં ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરજો. ૨૪મીથી ૪૨ દિવસ માટે તમારા સીધા કામ પણ સરખી રીતે પૂરા નહીં કરી શકો. ખોટા વિચારો અને ચિંતાથી પરેશાન થશો. રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. નાણાકીય મુશ્કેલીઓ આવતી રહેશે. દુશ્મનનું જોર વધી જશે. દરરોજ 'સરોશ યશ્ત' સાથે 'મહાબોખ્તારની આએશ' ભણજો. શુકનવંતી તા. ૨૨, ૨૩, ૨૫, ૨૮ છે.

Lucky Dates: 22, 23, 25, 28.

Jupiter's rule lasts upto tomorrow, so ensure that you cater to the wishes of your family members within these two days. Rahu's rule starting from the 24th, for the next 42 days, will not allow you to get much work done properly. You could end up with negative thoughts and fears. Rahu's rule will rob you of your sleep and your appetite. You could have to face financial difficulties. Your detractors will get more powerful. Pray the Mah Bokhtar Nyaish along with the Sarosh Yasht, daily.



Pisces - મીન - દ.ચ.ઝ.થ.ફ.

હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી દરેક કામ સંભાળી કરજો. સીધા ચાલતા હશે તો પાછળથી કોઈ ઘટકો મારી દેશે. નાણાકીય બાબતમાં ત્રણ બચાવવા જતા ત્રીસનો ખર્ચ થશે. વાહન સંભાળીને ચલાવજો. કામકાજમાં આળસ આવશે. ઉપરી વર્ગ તમને સતાવવામાં કોઈ કસર બાકી નહીં રાખે. દરરોજ 'મોટી હમન યશ્ત' ભણજો. શુકનવંતી તા. ૨૨, ૨૩, ૨૪, ૨૫ છે.

Lucky Dates: 22, 23, 24, 25.

Saturn's ongoing rule cautions you to be extra careful in doing your work. You could end up being hit by things out of the blue! Financially, despite your savings, you will end up spending many times over. Drive/ride your vehicles with safety. You could feel lethargic during work. Your seniors could cause much anguish. Pray the Moti Haptan Yasht daily.

Death By Suicide And Murder



RUBY LILAOWALA

Suicide is the most tragic form of exit from this world. It has to be seen in the light of great compassion and understanding, rather than contempt or condemnation. Suicide is the deliberate act of ultimate self-destruction in a fit of temper, fear, mental-depression, momentary despair or great disappointment.

In death by suicide, the definite life period (life-span), allotted and fixed for that soul's incarnation, has to be lived out, and there is no escape e.g. If a man with a life span of 80 years commits suicide at 50, then he has to spend the remaining 30 years in the most horrible conditions on the lowest sub-plane of the astral world, having destroyed his physical body.

One cannot 'escape' by suicide, because even after destroying the body, the person is 'wide awake' (conscious), on the other side of death. The circumstances which drove the person to suicide could be mental or emotional, and he simply cannot get rid of his mind or emotions. In fact, by losing the physical body, his capacity for suffering greatly increases and he goes over and over again, 'in imagination', all the circumstances that led to the final point when he killed himself, repeating the same feelings of despair, fear, anger and self-murder, going through the act and death-struggle with ghastly persistence for the remaining years of his life-span.



The folly in suicide is the futility of 'escape'. Instead, the soul falls, as it were, from the frying-pan into the fire. It is alleged that suicide cases have to suffer in the other world more than on the physical plane because their mind and emotions are working in a subtler matter, in which the impact and perception of feelings and emotions are a hundred times stronger (owing to less wastage in moving astral-light and astral-vibrational matter). The suicidal person's consciousness has more 'awareness' now and definitely more repentance, but since the body has been self-murdered, there is no way out except to suffer for the remaining years of its lifespan in the grey-zone, until the gates of the hereafter are open to him.

It is easy to condemn an unfortunate suicide-victim, but unless we know all the details that led a human being to that decision, we have no right to comment. Of course, the scales of karma are automatically adjusted by nature, but on our part, we must show mercy,

because these souls are extremely disturbed and in great distress on the other side of death. To help them, one can pray and send thought-healing from our side.

What about a person who is murdered by another? Murder is death caused by the violent act of one person against another, which, in nature's scheme of things, calls for a lot of forgiveness. Arthur Ford illustrates this with a story. Ford joined forces with mediums, psychics, para-psychologists and guides from the other side (astral world) to pierce the veil of the unknown and shed light on the most fascinating depths of psychic experiences, in realms other than our physical world. He writes about a mother whose only son has been murdered. She meets the murderer on the other side in 'heavenly' realms and is mad with anger and rage.

The murderer explains that he is here because her son 'forgave' him on the astral-plane. Thus, the son, because

of his ability to forgive and love his murderer, had gone to the highest realm (level) of Heaven. Ford relates how the mother is unable to forgive, forget or love the murderer and goes on suffering at the lower-level of Heaven for years. Ford ends his story by reminding the readers of Christ when he uttered, "Forgive them, for they know not what they do."

Another psychic and medium, Ruth Montgomery, who is an expert in karmic-astral-experiences that extend over thousands years from the temples of ancient Babylon to Palestine, in the time of Jesus Christ, relates in her book, 'Here and Hereafter', what became of Judas Iscariot after he betrayed Christ. Writes Montgomery, "That unhappy, totally misguided man, when he heard what had happened to Jesus, flung the dirty coins on those who had bribed him. Then he ran like a mad man into the countryside, and seeing a tree-branch, tore his cloak into segments, tied the strips together, and after looping one end around his neck, made a sort of lasso. Scaling the tree, he then jumped, breaking his neck and hanging there until his last breath left him. According to Ruth, "Judas has never re-incarnated." Even Arthur Ford says "Judas was the anathema of the Christian faith, the one among the chosen twelve who betrayed Jesus."

Death is full of surprises, and no one can take the end of life, its various circumstances, location or method for granted. But Montgomery says, "Prepare for death everyday." This is why a true initiate makes plans and is always prepared for what his psyche requires at the moment of death, making it less disturbing for himself and for others, by passing over in 'full consciousness and with love'.

P.T. CLASSIFIEDS

ANTIQUES

AARAV
OLD ANTIQUE ITEMS
VALUE GIVEN IS MORE THAN MARKET RATE
We also collect Goods & give free Home Service
Gold & Silver Jewellery, Watches, Old Furniture, Gramophones, All Records, All Cameras, Old Fountain Pens, Gara, Kerba, Old Crockery, Zari Border, Old Notes, Coins, German Silver, Household Items
CONTACT: AARAV
9324503876 / 8169751275
181, Shop No. 13, Bora Bazar, Fort, Mumbai-1

SERVICES AVAILABLE

DATTA Tempo Service for hire, shifting with skilled labourers. We regularly service - Mumbai to Pune, Nashik, Deolali, Sanjan, Nargol, Udvada, Navsari.
9821319228

www.parsi-times.com
 /parsi.times

PAC n DELIVER
INTERNATIONAL COURIER
Send parcels to your Children & loved ones in CANADA, UK, USA & WORLD WIDE including Garments, Farsan, Chocolates, Sweets, Gifts, Eatables, Medicines & any permissible item & get benefited with SPECIAL rates.
Contact - Mr. ANUJ SANGOI
Tel. - 022-48932230 / 8879991866
Email - sales@pacndeliver.com
"20 Yrs of Quality Service"

Good News
To Buy / Sell / Rent Flat / Plot / Bungalow in UDWADA and All Govt. Related Works
Call: Mr. Amit Tanna
0 9978850067

Printed and Published by Cyrus Firoz Printer on behalf of Parsi Times Multimedia Pvt. Ltd., Published at 2nd Floor, Khaitan Chambers C.H.S. Ltd., 143-145 Mody Street, Fort, Mumbai 400 001. Printed at M/s. Dangat Media Pvt. Ltd., 22 Digha M.I.D.C., TTC Industrial Area, Vishnu Nagar, Digha, Navi Mumbai, Thane - 400 708. Editor: Anahita Subedar. :: Contact Nos.: 66330404 Advt.: 66330405. Fax: 66330406 :: Office Timing: 10 a.m. to 5.30 p.m. Monday - Friday.

Those Were the Days



DARA M. KHODAIJI

Those were the days my friends', as the song goes, and I thought they'd never end but the days went by, each bringing unnoticeable changes, and over the years came the realization that things have changed, tremendously and the only constant in life is change itself. Of course, making a Socratesian or Aristotalean, face, we philosophize that without change, we would stagnate. Humbug! Change may be necessary, but I wish those good days would last longer. Much longer!

As a boy I remember waking up on New Year's day to the onomatopoeic 'thapak-thapak'. No, I don't mean the ad for the mosquito repellent on TV with a vapory hand going *thapak-thapak* upon the tiny pests, à la Mike Tyson. I am talking about my late mom doing the *sagan-na motta chawk*, the type reserved for *sara saporma divaso*, i.e. excessive. Sleep was no longer possible, especially if my neighbor got it into his head to live it up with the scratchy gramophone record blaring away the 'Sakhi suraj bhele-re ungio', that seemed to have been sung on Z flat. My late dad, normally a quiet and unassuming guy, not to be outdone, would play something equally devastating from his Collection of Souza's marches on his Garrard changer



that was out of bounds for me.

Still-hour, one went for the festival bath that includes a *fuliu* (small cuplike vessel) of milk, mixed with rose petals, some *kum-kum* and some grains of rice that was poured over the head... possibly a left-over Cleopatric tradition of the Egyptian queen who used to bathe in milk or so it is said.

Exit the bath, and on to the dining table for a sumptuous breakfast of *sev* (vemicelli) smothered with fried slivers of almonds, pistachios and raisins, yoghurt and a boiled egg. Dressed in new New Year finery, yours truly would stand on the *chawk*, be garlanded and receive a cash gift of Re.1 or 3 or 5 and would go visiting the good, generous granny to receive couple of those heavy, rich rupee coins with the face of the King Emperor George VI, that were still in circulation; and more from *Mama*, *Mami* and an assortment of other relatives. With all

the wealth, off to the Atashbehrams play usually at Sir Cowasji Jahangir hall. The play would run in two parts, a love story and a comedy with songs that were commentaries or reflections on post-independence times. The romance would be between a daughter of an aristocrat father, a Sir someone Flan-flan, or the other way around. There would be a comical major-domo, probably an Irani speaking highly accented Gujarati. A proper melodrama, the plot would thicken with a lot of "Pappa I will die without him," or "over my dead body" or "never darken my doorways with your presence ever again" and so on. Very dramatic! Somewhat like an ancient Greek tragedy they were!

Back home to be serenaded by the roving *bandwallas*, popularly known amongst the Parsis as the *Nankhatai band*, playing the inevitable 'Isle of Capri', 'Sir Jamsetjee Jejeebhoy' and couple of other tunes. There would be hush-hush-served beer, those being the prohibition days, a couple gulps of the amber blessing on hot summer days from the glasses left unguarded and on to the lunch of *sali-boti*, *patties*, fried fish and *dhan-dar patio*.

A brief siesta and getting for an

evening at some Parsi natak, play usually at Sir Cowasji Jahangir hall. The play would run in two parts, a love story and a comedy with songs that were commentaries or reflections on post-independence times. The romance would be between a daughter of an aristocrat father, a Sir someone Flan-flan, or the other way around. There would be a comical major-domo, probably an Irani speaking highly accented Gujarati. A proper melodrama, the plot would thicken with a lot of "Pappa I will die without him," or "over my dead body" or "never darken my doorways with your presence ever again" and so on. Very dramatic! Somewhat like an ancient Greek tragedy they were!

Back home to pre-prandial whisky, wine or whatever and your writer once again scouring the landscape for potluck from variety of carelessly left glasses. One more sumptuous dinner, ordered days in advance from a Parsi caterer, ice-cream probably from an Irani restaurant, and a lot of *adieu aavjo fari thi* and *ta-tas!* And the wait began for the next New Year be celebrated on the *Jamshedi Navroz day*. Us Parsis are the truly chosen people, three New Years, two birthdays, two anniversaries.... Now let me tell you of my great-uncle from Aden who once... Ooops! Sorry, my madam editor is screaming, "tukku karo. Enough of tamaro lavar!" So, I'll tell you about my father's Khan-Bahadur Nadarsha Kaka, OBE from Eden, another time.

The memories of the days of yore came flooding this year when very few could venture out to Agiaries, Atashbehrams, to plays, cinemas or go dining out. We made the best of it at home with maybe a couple of dear ones or with our neighbours. But most of us are safe and secure in our little homely cocoons, waiting and wishing for good times to come again. And come, they will!



The Zen Series: The Gates Of Paradise



KASHMIRA SHAW RAJ

Parsi Times presents our readers 'The Zen Series' by PT Columnist, Kashmiri Shaw Raj – a professional Taichi and Qigong practitioner and teacher, as also a sought-after clinical psychologist and healer. These Zen stories will resonate with you and help you connect within, at a deeper, inner level to encourage and empower you to reflect. These make for good reading across people of all ages and speak to the reader at several levels. If you're looking to bring about a positive change in yourself, 'The Zen Series' will inspire, motivate and facilitate you in realizing truths about yourself and life, to ultimately set you on the path of growth, wisdom and happiness.

In the eighth episode of 'The Zen Series', we learn an important lesson based on the story - 'The Gates of Paradise'.

A soldier named Nobushige came to Hakuin, and asked, "Is there really a paradise and a hell?"

"Who are you?" inquired Hakuin.

"I am a samurai," the warrior replied.

"You, a soldier!" exclaimed Hakuin. "What kind of ruler would have you as his guard? Your face looks like that of a beggar!"

Nobushige became so angry that he began to draw his sword, but Hakuin continued, "So you have a sword! Your weapon is probably much too dull to cut off my head."

As Nobushige drew his sword, Hakuin remarked, "Here open the gates of hell!"

At these words, the samurai,



perceiving the master's discipline, sheathed his sword and bowed.

"Here open the gates of paradise," said Hakuin.

[Courtesy: 'Ten Very Best Zen Stories for Travelers']

Heaven or Hell is not up there. It's all here, and it's all within. Different opportunities present themselves to us and how we react to them brings out the true character of man. Everyone faces hardships in life, only the degrees vary. Reactions to these differ. Some accept things positively and decide to work on themselves. Some find it difficult to accept and have mixed emotions. Others face denial and run away from the situation.

So, what state do you possess and nurture within? Heaven or Hell?

There is the sense of experiencing Heaven within, when:

1. There is a sense of inner peace and calmness
2. You relate to others with harmony and humility
3. Things go smoothly for you
4. Even when there is a challenging situation before you, you have the ability to face it without going through immense turmoil.
5. There is love and compassion you feel for people around.
6. You are able to understand the other person's point of view without being judgmental.

However, there is a sense of experiencing Hell when:

1. There is unrest, turmoil and unhappiness within.
2. A sense of despair or hopelessness overcomes you.
3. Anger, rage, pride, arrogance and other such extreme emotions seem to be ruling your life
4. Nothing seems to be working.
5. There is a disconnect with people. No one seems to understand you and vice versa.
6. Everything seems futile and useless around you.

We all know only too well that it takes a long time to create or build something, while it takes next to no time at all to break or destroy. Our thoughts, actions, emotions and feelings - all make up our inner world, which in turn is reflected in our outer world.

It is important to note that only inner peace and calmness will be able to contain outer storms. However, a


disturbed inner state of mind will affect even the quietest of environments outside.

Therefore, wouldn't you rather be in a situation where:

1. We are the masters of our emotions, rather than being the slave.
2. We think of the one life we have and work on making it better, rather than keeping it for later.
3. We realise that humility makes magic. Greater the rise, the humbler you must remain!
4. We avoid getting caught up in repetitive unwanted situations that seem to have set an unhealthy pattern in your life.
5. We realise that life is meant to be enjoyed. Do not look upon it as a moral conduct book!



Remember always - it is entirely up to us to make a difference in our lives. Challenges will come in the lives of all, but they will go as well - nothing is permanent. It is what you do in the interim that governs whether you will choose to live in Heaven or Hell.



Kashmira Shaw Raj is a professional Taichi and Qigong practitioner and teacher. Also, a successful clinical psychologist, psychic and healer, Kashmiri runs 'The Tai-Qi Touch' with her husband, Dr. Brijesh Raj, a healer and a Vet. Taichi practitioners for over fourteen years now, they are instructors in Sifu Carlton Hill's Tao Taichi Qi Gong organization, and Shibashi Instructors under Sifu Wing Cheung from the Feng Shui and Taichi Institute, Hongkong & Canada.

The Tai-Qi Touch offers classes for adults and children at 'Infinite Studio' (Opp. Starbucks Café, Chowpatty, Mumbai). To contact Kashmiri, M: 9323874418 or Email: kash.shaw@gmail.com